



અમેરિકાની સેનેટમાં રજૂ થયું નવું બિલ,  
અનેક ભારતીય ડોક્ટરોને મળશે લાભ

PAGE NO. 18

# સ્વદેશ

પરદેશમાં દેશની મહેક એટલે

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH



મુંબઈના મલાડમાં ચાર માળની ઇમારત  
ધરાશાયી થતાં 11નાં મોત, સાત ઘાયલ

PAGE NO. 17

FRIDAY, 11 JUNE, 2021 Vol. 18, No. 24 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news


**ચાઈનીઝ એપ કૌભાંડ** યુઝર્સનો અગત્યનો ડેટા ચોરવાના આરોપસર 11ની ધરપકડ

# 5 લાખ ભારતીયને 150 કરોડનો ચૂનો

પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની મોબાઇલ એપથી છેતરપિંડી, આરોપીમાં બે સીએ પણ સામેલ

નવી દિલ્હી

કોરોના કાળમાં ચીનના લોકોએ 5 લાખ ભારતીયો સાથે છેતરપિંડી કરીને તેમના કરોડો રૂપિયા પચાવી પાડ્યા છે. નક્લી ચાઈનીઝ એપ દ્વારા ચીને દેશના લાખો લોકોનો ડેટા ચોરીને તેમને નાણા ડબલ થવાની લાલચ આપીને તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મોબાઇલ એપ પાવર બેંક અને ઇઝેડ પ્લાન દ્વારા બે મહિનામાં પાંચ લાખથી વધુ લોકોએ 150 કરોડ રૂપિયાથી વધુની રકમ ગુમાવી છે.



કાર્યવાહી માનવામાં આવે છે. પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે આ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે અને તેમને ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે પાવર બેંક નામની મોબાઇલ એપે પોતાને બેંગાલુરુની કંપની ગણાવી હતી જો કે આ એપનું સર્વર ચીનમાં આવેલું છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે સીએનો પણ સમાવેશ થાય છે જેઓ રોકાણ કરાયેલા નાણા મોકલવા માટે નક્લી કંપનીઓ બનાવતા હતાં.

દિલ્હી પોલીસના સાયબર સેલે ઇન્ટરનેટ મીડિયા પર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈ આ રેકેટ સાથે સંકળાયેલા 11 લોકોની ધરપકડ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. છેતરપિંડી કરીને એક્ટ્ર કરાયેલા 150 કરોડ રૂપિયા પૈકી 11 કરોડ રૂપિયા વિવિધ બેંકોમાં બ્લોક કરી દેવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 11 લોકોને પકડી પાડ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર સેલની આ સૌથી મોટી

આ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે 110 શેલ કંપનીઓની રચના કરી હતી. આ કંપનીઓને ચીનના નાગરિકોને બે થી ત્રણ લાખ રૂપિયામાં વેચી દીધી હતા.

# વસવાટ કરવા માટે ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ વિશ્વનું નંબર 1 શહેર

વિશ્વમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ દમાસ્કસ શહેરની છે

લંડન

કોરોના મહામારીએ વિશ્વને ઘેરી લીધા બાદ એક સમયે રહેવા માટે ટોચના ક્રમે પસંદ થતા શહેરોની યાદીને પણ હચમચાવી દીધી છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પડેલી રહેવા માટે સૌથી વધુ પસંદ થતા શહેરોની બહાર પડેલી રેન્કિંગ યાદીમાં યુરોપના શહેરોને મુકાબલે ઓસ્ટ્રેલિયા, જાપાન અને ન્યૂઝીલેન્ડનાં શહેરો આગળ નીકળી ગયાં છે. ધ ઇકોનોમિસ્ટના વાર્ષિક સર્વેક્ષણ મુજબ ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ શહેર વિશ્વમાં રહેવા માટે સૌથી વધુ પસંદ થતું ટોચનું શહેર બની રહ્યું છે. તે પછીના ક્રમે જાપાનના ઓસાકા અને ટોક્યો, ઓસ્ટ્રેલિયાનું એડિલેડ અને ન્યૂઝીલેન્ડનું વેલિંગ્ટન શહેર સૌથી વધુ પસંદગી પામી રહ્યું છે. આ તમામ શહેરોએ કોરોના મહામારી નિયંત્રણ મુદ્દે દાખલો બેસાડે તેવી કામગીરી કરી છે. સર્વે અહેવાલમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને અંકુશમાં લેવાને મુદ્દે ઓકલેન્ડે સફળ



દૃષ્ટિકોણનો પરિચય આપ્યો છે. તે કારણે જ ઓકલેન્ડ વિશ્વમાં રહેવા માટે સૌથી પસંદગીનું શહેર બની રહ્યું છે. વિશ્વમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ દમાસ્કસ શહેરની છે. સીરિયામાં ચાલી રહેલા આંતરવિગ્રહને કારણે દમાસ્કસમાં જીવવું ખૂબ જ મુશ્કેલ છે. વર્ષ 2017થી 2020 દરમિયાન યાદીમાં ટોચના સ્થાને રહેલા વિયેના શહેર રેન્કિંગમાં 12મા સ્થાને ધકેલાઈ ચૂક્યું છે.

યુપીમાં મોદી-યોગી વચ્ચે તનાવ, બેઠકોમાં ફક્ત CM: પોસ્ટર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાયબ

PAGE NO. 15

ફૂટબોલ યૂરો કપ 2020નો 11મીથી પ્રારંભ

PAGE NO. 19

**SUPER VISA INSURANCE**

Get Full REFUND if visa is declined  
Get partial refund if parents leave early\*  
\*conditions apply.... Ask NOW for a free quote...

Sanjiv Puri  
Insurance Broker  
Ph.: 416-890-3232  
Email: sanjivpuri@rogers.com

StarLife  
Insurance & Investments Inc.  
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE  
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

Need mortgage financing?  
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL  
Mobile Mortgage Specialist  
Royal Bank of Canada  
bhavin.patel@rbc.com  
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069  
Serving Greater Toronto Region Fax: 416-253-9461

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

**Ashok Travels 416-977-9896** અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com  
Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Residential  
New Condos  
Investments  
Commercial

દુસામાં યાદ રાખરો

Zakir Patel  
Broker  
Cell: 416-561-7973  
Office: 416-287-2222

RE/MAX  
COMMUNITY  
Realty Inc., Brokerage  
Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email: patelzakir82@gmail.com

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor

ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002



# કોરોનાના વળતા પાથી : 1146 કેસ, 20ના મોત

સૌથી વધુ ઓન્ટેરિયોમાં 590 સંક્રમિતો મળી આવ્યા, દેશમાં 873 લોકોની હાલત અત્યંત ગંભીર



## ઓન્ટેરિયોમાં કોરોનાનું સંક્રમણ ઘટવા માંડ્યું: વેક્સીનેશનમાં પણ પ્રાંત અગ્રેસર

છેલ્લા સાત દિવસમાં કેસની સરેરાશ 1029થી ઘટીને 735 સુધી આવી ગઈ

ઓન્ટેરિયો : કેનેડામાં કોરોના વાયરસની ગતિ પર જોરદાર બ્રેક વાગતી અનુભવાય રહી છે. ગુરુવારે સમગ્ર દેશમાં કોરોનાથી સંક્રમિતોનો આંકડો માત્ર 873 નોંધાયો હતો. જ્યારે 24 કલાકમાં કોરોનાથી મોતને ભેટનારાઓની સંખ્યા પણ 20 રહી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુરુવારે સાંજ સુધીના વીતેલા 24 કલાકમાં કેનેડાના ઓન્ટેરિયોમાં સૌથી વધુ 590 કોરોના સંક્રમિતો મળવા સાથે અહીં 11 દર્દીના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત ક્યુબેકમાં નવા 189

લોકો કોરોનામાં સપડાયા હતા. જ્યારે અહીં મોતને ભેટનારા દર્દીઓની સંખ્યા બે રહી હતી. દિવસ દરમિયાન ક્યુબેકમાં 255 દર્દીઓ રિકવર થયા હતા. મોનીટોબામાં ગુરુવારે નવા 251 દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. જ્યારે 24 કલાકમાં મોનીટોબામાં 6 દર્દીના મોત થયા હતા. આ ઉપરાંત સાર્સ્કેચવાનમાં ગુરુવારે 7 સેમ્પલના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ગુરુવારે સાંજની સ્થિતિએ કેનેડામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 20377 નોંધાયો હતો.

ટોરોન્ટો : ઓન્ટેરિયોએ કોવિડ-19ના સૌથી ઓછા દૈનિક કેસની બાબતમાં અગ્રેસર રહીને વિક્રમ નોંધાવ્યો છે. જે દૈનિક 400થી ઓછા કેસ છે. આ આંકડો સપ્ટેમ્બર 2020 પછીનો છે. એ રીતે જ પ્રાંતમાં વેક્સીનેશન ઝુંબેશ પણ વેગ પકડ્યો હોવાથી એમાં પણ વિક્રમ નોંધાયો છે. સોમવારે આરોગ્ય અધિકારીઓએ કોરોનાના પરપ કેસ નોંધાયા હોવાનું અને એને કારણે 14 વધુ મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું. જે અગાઉના દૈનિક ૬૬૩ અને શનિવારના રોજ નોંધાયેલા ૭૪૪ કેસની સરખામણીમાં ઘણાં ઓછા હોવાનું જણાવ્યું હતું.

વિસ્તારમાં છેલ્લા સાત દિવસમાં કેસની સરેરાશ 1029થી ઘટીને 735 સુધી આવી ગઈ હતી. પ્રાંતમાં પોઝીટીવીટી રેટ ૩.૬% છે. જે કુલ 14,100 ટેસ્ટમાંથી ગણતરીમાં લેવાયો

છે. ૨૭મી સપ્ટેમ્બરે ૪૮૧ કેસ નોંધાયા હતા. પ્રાંતના એપિડેમોલોજી રીપોર્ટ મુજબ ત્રણ આરોગ્ય કેન્દ્રોમાં ૫૦થી ઓછા કેસ જોવા મળી રહ્યા છે. જેમાં નવા ઈન્ફેક્શનની અસર હોય છે. આ ત્રણ મ્યુનિસિપાલિટીઓમાં ટોરોન્ટો (૧૧૪), પીલ (૮૬) અને વોટરલુ (૫૧)નો સમાવેશ થાય છે. એ રીતે જ વેક્સીનેશનના મુદ્દે પણ પ્રાંત અગ્રેસર રહ્યો છે. ઓન્ટેરિયોમાં ૧૦ મિલીયનથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે. સ્થિતિ સામાન્ય બનતા જનરલ રીટેલ સ્ટોર્સ ખોલવાની છૂટ પણ અપાઈ છે. એક અહેવાલ મુજબ પ્રાંતમાં રવિવાર સુધીમાં એક મિલીયનથી વધુ લોકોએ બંને ડોઝ લઈ લીધા હતા અને એ આંક હવે ૧૦૩૧૫૨૦ સુધી પહોંચી ગયો છે. ઉનાળો પુરો થતા સુધીમાં ઓન્ટેરિયો પ્રાંતમાં વેક્સીનેશન પૂર્ણ થઈ જવાની શક્યતા છે.

કેસનો પોઝિટિવીટી રેશિયો પણ 3.6 ટકા જ નોંધાયો, પ્રદેશમાં રસીના 10 મિલિયનથી વધુ ડોઝ અપાયા

## કેનેડામાં કોવિડ-19ની પહેલી લહેરમાં ઈમિગ્રન્ટસ વધુ ભોગ બન્યા : અહેવાલ

ટોરોન્ટો : સ્ટેટિસ્ટીક્સ કેનેડાના નવા જાહેર થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીના પહેલા વેવમાં મૂળ કેનેડીયનોની સરખામણીમાં ઈમિગ્રન્ટસ વધુ મૃત્યુ પામ્યા હતા.

બુધવારે પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, ઈમિગ્રન્ટસના વધુ મૃત્યુ દર પાછળના કારણોમાં એમનું કાર્યક્ષેત્ર અને ગીચ રહેઠાણ હતા. કામનો વધુ પડતો બોજો અને ગીચ વસતિને કારણે એમનામાં સંક્રમણનું પ્રમાણ પણ વધુ હતું. કેનેડામાં કોરોનાને કારણે નોંધાયેલા વરિષ્ઠ નાગરિકોના મૃત્યુમાં પણ ઈમિગ્રન્ટસનો આંક મૂળ કેનેડીયનોની સરખામણીમાં વધુ હતો. એક સર્વેક્ષણ મુજબ કેનેડામાં કોવિડ-19ને કારણે નોંધાયેલા મૃત્યુઓમાં ૨૫ ટકા માર્ચ ૨૦૨૦ સુધીમાં ઈમિગ્રન્ટસના હતા. જો કે, જુલાઈમાં એ ટકાવારી ઘટીને ૨૨ ટકા થઈ હોવાનો ઉલ્લેખ પણ અહેવાલમાં જોવા મળે છે.

આ ટકાવારી ૨૦૧૬ની વસતી ગણતરીને આધારે કાઢવામાં આવી હતી. ૬૫ વર્ષથી ઓછી વયનાઓના મૃત્યુદરમાં પણ ૨૦ ટકા ઈમિગ્રન્ટસ હતા. ઈમિગ્રન્ટસના આ અપ્રમાણ મૃત્યુદરમાં પણ પુરૂષોનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.

ઓન્ટેરિયો, ક્યુબેક અને આંશિક રીતે બ્રિટીશ કોલંબિયામાં જ્યાં ઈમિગ્રન્ટસની વસતિ કુલ વસતિના ૨૮ ટકા જેટલી છે પરંતુ કોવિડ - 19 સંબંધિત

### કામનો વધુ પડતો બોજો અને ગીચ વસતિને કારણે ઈમિગ્રન્ટસમાં વાયરસનું સંક્રમણ વધુ રહ્યાનું તારણ

મૃત્યુમાં એમની ટકાવારી ૪૧ ટકા જોવા મળી હતી. સ્ટેટકેનના અહેવાલ મુજબ ક્યુબેકમાં કોવિડ-19થી થયેલા મૃત્યુમાં અડધો અડધ એટલે કે ૪૮ ટકા ઈમિગ્રન્ટસના મૃત્યુ હતા. જ્યારે ઓન્ટેરિયોમાં ૪૫ ટકા અને બ્રિટીશ કોલંબિયામાં ૪ ટકા હતા. જ્યારે ઈમિગ્રન્ટસ નહીં હોય, એવામાં આ ટકાવારી અનુક્રમે ૨૩ ટકા, ૨૨ ટકા અને ૨ ટકા જેટલી હતી. અહેવાલમાં જણાવાયું છે કે, માર્યા ગયેલા ઈમિગ્રન્ટસ પૈકી સૌથી વધુ પ્રમાણ મોન્ટ્રીયલ, ટોરોન્ટો અને વાન્કુવરમાં જોવા મળ્યું હતું. એ પૈકીના મોટાભાગના 1980 પહેલાથી કેનેડામાં આવીને વસેલા હતા.

જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારા ઈમિગ્રન્ટસ પૈકી નવ ટકા તો 2000 અને 2017 વચ્ચે કેનેડા આવનારા હતા. એ બધા જ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા હતા. મોટાભાગના તો એશિયાના હતા. એમનું કાર્યક્ષેત્ર અને રહેણાંકની ગીચતાને કારણે તેઓ ઝડપથી સંક્રમિત થયા હોવાનું અનુમાન પણ અહેવાલમાં વ્યક્ત કરાયું હતું.

## ઓન્ટેરિયોમાં ઈન વ્હીકલ રોડ ટેસ્ટ શરૂ થશે

ટોરોન્ટો : જે લોકો ઈન વ્હીકલ ડ્રાઈવિંગ ટેસ્ટની એપોઈન્ટમેન્ટ લેવા રાહ જોઈ રહ્યા હતા તેમને માટે આનંદના સમાચાર છે. ટોરોન્ટોમાં આવતા અઠવાડિયાથી ઈન વ્હીકલ રોડ ટેસ્ટ શરૂ થઈ રહ્યા છે. જુનની 14મી તારીખથી આખા પ્રાંતમાં ટેસ્ટ શરૂ થશે અને એને માટે ડ્રાઈવરો જી-1, જી -2, એમ -1 અને એમ - 2 માટેના

ડ્રાઈવ ટેસ્ટ બુક કરાવી શકશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, લોકોની માંગણીને ધ્યાને રાખી આ ટેસ્ટ વહેલો તે પહેલોના ધોરણે લેવાશે. ઈન વ્હીકલ ટેસ્ટ એપ્રિલ માસથી આ ટેસ્ટ બંધ કરાયા હતા. જે હવે ફરીથી શરૂ થઈ રહ્યા છે. આ અંગે વધુ જાણકારી માટે લોકોને : DriveTest.ca વેબસાઈટની મુલાકાત કરવા જણાવાયું છે.

કથા, હવન, ગાયત્રી યજ્ઞ,  
વાસ્તુ પૂજન, ગ્રહશાંતિ,

જીટીએમાં દરેક જગ્યાએ  
અમો સેવા આપીએ છીએ.

શશીકાંત ભટ્ટ

૯૦૫ ૪૫૬ ૭૬૨૨

કાલસપ્તે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ,  
વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન,  
બેબી શાવર, જેવા કાર્યો માટે  
સંપર્ક કરો.

Shashikant Bhatt

Home: 905-456-7622  
Cell: 416-258-2750

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

**INVEST WITH** **Capital**

Sharia'h Compliant

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects **plus** your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

MOHAMMAD ABOWATH  
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH  
BROKER

IBRAHIM ABOWATH  
SALES REPRESENTATIVE

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

**RE/MAX**  
CROSSROADS REALTY INC.

#SellwithABOWATH  
your Local REALTOR

\*Not intended to Solicit client under contract.



તંત્રી સ્થાનેથી

# એલન મસ્ક અને બેજોસની નજર હવે સ્પેસ ટુરિઝમ ઉપર

આ દિકાળથી માનવી જિજ્ઞાસુ રહ્યો છે અને તેને હંમેશા જળ, ધરતી, પાતાળ અને અંતરિક્ષના રહસ્યો જાણવાની ઉત્કાંઠા રહેલી છે. એમાં પણ અવકાશ તરફ માનવીની દોટ પહેલેથી રોમાંચક રહી છે. ૧૯૫૭માં સોવિયેત સંઘે માત્ર ૫૯ સેમીના પહેલાવહેલા

તંત્રી - પ્રકાશક  
સ્વદેશ

સનસનાટી ફેલાવી દીધી હતી. અંતરિક્ષમાં જઈને આ સેટેલાઈટ પૃથ્વી પર સિગ્નલો મોકલવાની શરૂઆત કરી ત્યારે દુનિયામાં રોમાંચ વ્યાપી ગયો હતો. શરૂઆતના વર્ષોમાં અમેરિકા અને સોવિયેત સંઘે પહેલા અવકાશ અને પછી ચંદ્ર સુધી પહોંચવાની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. જોકે ચંદ્રની ધરતી સાવ નિર્જીવ અને નપાણી જણાતા આ દેશોનો ચંદ્રમાંથી રસ ઓછો થઈ ગયો. ત્યારબાદ મંગળ ગ્રહ તરફ સંશોધકોનું આકર્ષણ વધ્યું છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં માત્ર મંગળ જ એવો ગ્રહ છે જ્યાં માનવજીવનની સંભાવના દેખાઈ છે. મંગળ ગ્રહમાં વૈજ્ઞાનિકોને ખાસ રસ હોવાનું બીજું કારણ એ છે કે, આ ગ્રહનો વર્તમાન જોતા એવું લાગે છે કે ભૂતકાળમાં ત્યાં જીવન પાંગર્યું હશે. ઘણાં વૈજ્ઞાનિકોને તો પૃથ્વીનું ભવિષ્ય પણ હાલના મંગળ જેવું જ હશે તેમ લાગે છે. હાલ તો મંગળ પરનું વાતાવરણ સાવ પાંખું છે અને માનવવસવાટને યોગ્ય નથી. પરંતુ વૈજ્ઞાનિકોને આશા છે કે, ભવિષ્યમાં ટેકનોલોજી દ્વારા મંગળ ગ્રહને વસવાટ કરવા માટે લાયક બનાવી શકાશે.

આજે અમેરિકા, રશિયા, ચીન અને યુરોપના દેશો અંતરિક્ષ તરફ દોટ લગાવી રહ્યાં છે. હવે આ રેસમાં ભારત પણ આ દેશોની સરખામણીએ ક્યાંય ઓછાં ખર્ચે અને વધારે ઊંચા સ્ટ્રાઈકરેટ સાથે આગળ વધી રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોથી ખાનગી કંપનીઓ પણ અવકાશયાત્રામાં ઘણો રસ લઈ રહી છે. અમેરિકાની કંપની સ્પેસએક્સ આ રેસમાં સૌથી આગળ છે. વર્ષ ૨૦૦૨માં અમેરિકાના બિઝનેસ ટાયકૂન એલન મસ્કે આ કંપનીની સ્થાપના કરી હતી. અનેક કંપનીઓ ધરાવતા એલન મસ્કની દરેક કંપનીનો હેતુ એક જ છે અને એ છે માનવી ઉપર તોળાઈ રહેલા ત્રણ જોખમોના તોડ શોધવા. આ ત્રણ જોખમ છે, ક્લાયમેટ ચેન્જ, માત્ર પૃથ્વી પર માનવીની નિર્ભરતા અને માનવ પ્રજાતિ સાવ નકામી બની જવાનો ખતરો. જેમ જેમ મશીનો સક્ષમ બની રહ્યાં છે તેમ તેમ માણસો નકામી બની રહ્યાં છે.

ટેસ્લા મોટર્સ, સોલર સિટી અને ધ બોરિંગ કંપની ઊર્જાના સ્વચ્છ વિકલ્પોનો ઉપયોગ કરીને ક્લાયમેટ ચેન્જ સામે લડવાની પ્રયાસ કરી રહી છે. હવે એમેઝોનના સ્થાપક જેફ બેજોસ ૨૦મી જુલાઈએ પોતાના ભાઈ માર્ક બેજોસ સાથે અંતરિક્ષની સફરે જવાની તૈયારી કરી રહ્યા છે. અંતરિક્ષની સફર જેટલી ખર્ચાળ છે એટલી જ જોખમી પણ છે. જે રોકેટમાં બેજોસ બંધુઓ જવાના છે એ ન્યૂ શેપર્ડનું ૧૪ વખત પરીક્ષણ થયું છે. એલન મસ્ક અને જેફ બેજોસની નજર સ્પેસ ટૂરિઝમ ઉપર છે.

બેજોસે આ સ્પેસ ક્રાફ્ટને એનએસ-૧૪ નામ આપ્યું છે. સ્પેસ ટૂરિઝમ થોડી મિનિટોનું જ હોય છે. અંતરિક્ષમાં બહુ દૂર પણ લઈ જવામાં આવતા નથી. અર્થ ઓબિટલની બહાર સબ ઓબિટલ સ્પેસમાં લઈ જઈ મુસાફરને ગ્રેવિટીલેસ એટમોસ્ફીયરની અનુભૂતિ કરાવાશે. બંનેએ અંતરિક્ષમાં લોકોને ફરવા મોકલવાના પ્લાનિંગથી માંડીને કોલોની વસાવવા સુધીની વાતો કરી છે. સ્પેસ ટૂરિઝમની ઘણી બધી વાતો સામાન્ય લોકો માટે પરીકથાઓ જેવી જ છે. દુનિયાના રિચેસ્ટ

પર્સન્સમાં જેમની ગણના થાય છે એવા જેફ બેજોસ અને એલન મસ્કની નજર ઘણા સમયથી સ્પેસ ઉપર મંડાયેલી છે. જમીન, દરિયા અને આકાશમાં તો અનેક લોકોએ અત્યાર સુધીમાં ઘણુંબધું ખેડાણ કરી લીધું છે. હવે બિયોન્ડ ધ સ્કાય અને જ્યાં ગ્રેવિટીના નિયમો કામ કરતા નથી એવા અંતરિક્ષમાં બંનેની નજર ઠરી છે. વિમાનમાં હોય છે તેનાથી ત્રણ ગણી મોટી ઓબ્ઝર્વેશન વિન્ડોમાંથી અંતરિક્ષ જોઈ શકશે. ડેનિસ ટીટોનું નામ ફર્સ્ટ સ્પેસ ટૂરિસ્ટ તરીકે નોંધાયેલું છે. ૨૦૦૧માં તેઓ રશિયન સોયૂઝ યાનમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા અને આઠ દિવસ રોકાયા હતા. હાલ જેફ બેજોસે એવી જાહેરાત કરીને બધાને ચોંકાવ્યા છે કે, તેઓ પોતાના ભાઈ માર્ક સાથે ૨૦મી જુલાઈના રોજ અંતરિક્ષની સફરે જવાના છે. તેઓ જે યાનમાં બેસીને અંતરિક્ષની સફરે જવાના છે તે માટે ડરાજી થઈ હતી. ૧૪૩ દેશોના ૬ હજારથી વધુ લોકોએ ડરાજીમાં ભાગ લીધો હતો. સૌથી ઊંચી બોલી ૨૮ લાખ ડોલરની હતી. આ રકમ બ્લૂ ઓરિજિન ફંડેન્સને દાનમાં આપી દેવાશે.

હવે અંતરિક્ષમાં જવા માટે ૨૦મી જુલાઈ પસંદ કરવા પાછળ પણ રસપ્રદ કારણ છે. ૨૦મી જુલાઈએ મૂન ૩ છે. ૨૦મી જુલાઈ, ૧૯૬૯ના રોજ એપોલો-૧૧ યાન નીલ આર્મસ્ટ્રોંગને લઈને ચંદ્ર પર પહોંચ્યું હતું. એમેઝોન છોડીને જેફ હવે સ્પેસ ટૂરિઝમ માટે બનાવેલી બ્લૂ ઓરિજિન સ્પેસશિપ કંપની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. એ સિવાય પણ જેફ પોતાના અન્ય વેન્ચર્સ બેજોસ અર્થ ફંડ, એમેઝોન ૩ વન ફંડ અને ધ વોશિંગ્ટન પોસ્ટ સાથે તો જોડાયેલા છે જ. જેફને ખબર છે કે, પોતાની સ્પેસ કંપનીને આગળ લઈ જવા માટે પોતાની અંતરિક્ષ સફર જરૂરી છે.

જેફે કહ્યું કે, સ્પેસમાં ફરવા જવું એ તો મારું સપનું હતું. ઈન્સ્ટાગ્રામ પર બેજોસે લખ્યું કે, અંતરિક્ષમાંથી ધરતીને જોવી એ એક એવી ઘટના છે જે આપણને બદલી નાખે છે. જેફ બેજોસની બ્લૂ ઓરિજિન સ્પેસ કંપની સામે એલન મસ્કની સ્પેસએક્સ કંપનીને સ્પર્ધા છે. એલન મસ્કના ઈરાદા તો સ્ટારશિપ નામના સ્પેસ ક્રાફ્ટ દ્વારા મંગળ ગ્રહ સુધી પહોંચીને મંગળ પર કોલોની બનાવવાના છે. એલન મસ્ક નાસા સાથે મળીને વિશ્વમાં પહેલી વખત મહિલાને ચંદ્ર પર મોકલવાના મિશન પર પણ કામ કરી રહ્યા છે. મે મહિલામાં જ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સાથે એલન મસ્કે મૂન મિશન માટે ૨.૮૯ અબજ ડોલરના કરાર કર્યા હતા. જેફ બેજોસ પણ નાસા સાથે કરાર કરવા માટે ઉત્સુક હતા, પરંતુ એલન મસ્ક બાજી મારી ગયા હતા.

નાસા સાથેની ડીલના મામલે પણ જેફ અને એલન વચ્ચે ચડભડ થઈ હતી. જેફે એવું કહ્યું હતું કે, નાસાએ ખોટી રીતે એલન મસ્ક સાથે ડીલ કરી છે. તેની સામે એલન મસ્કે ટોણો માર્યો હતો કે, એવું કરવાની જેફ બેજોસની તાકાત નથી. સ્પેસ ટૂરિઝમના ક્ષેત્રમાં બેમાંથી કોણ કાઠું કાઢે છે એના પર હવે આખી દુનિયાની નજર મંડાયેલી છે. અંતરિક્ષમાં ફરવા જવું એ ખર્ચાળ તો છે જ સાથોસાથ જોખમી પણ છે. આમ છતાં દુનિયામાં એવા અસંખ્ય માલેતુજારો છે જેને અંતરિક્ષમાં ફરવા જવાની ઈચ્છા છે. જેફ બેજોસની બ્લૂ ઓરિજિન, એલન મસ્કની સ્પેસએક્સ ઉપરાંત રિચર્ડ બ્રોનસનની વર્જિન ગાલાસ્ટિક, ફેક બન્જરની ઓરિઅન સ્પાન, બોઈંગ સહિત અનેક કંપનીઓ અત્યારે સ્પેસ ટૂરિઝમ પર કામ કરી રહી છે. એલન મસ્કે પણ અંતરિક્ષની સફરે જવાની ઈચ્છા વ્યક્ત કરી જ છે પણ જેફ બેજોસ તેના પહેલાં જઈ આવશે! બંને વચ્ચે અંતરિક્ષમાં જવા માટે પણ હરીફાઈ હતી જ!

મનોજ ગાંધી

manoj1968@yahoo.ca

INDEPENDENTLY OWNED AND OPERATED

**JAY PATEL**  
BROKER

**647.241.3818**  
jaypatel1323@gmail.com

**"Let Me Make Your Dream Home Into A Reality"**

**Residential, Commercial & Investment in Real Estate**

Off : 905.456.1000 | Fax : 905.456.1924  
295 Queen Street East, Brampton, On., L6W 3R1

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com

✓ Mice  
✓ Rat

✓ Cockroach  
✓ Bedbug

**SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL**

✓ Animal Control

✓ Bird Control

**WE SPEAK ENGLISH, GUJARATI & HINDI**

✓ WASPS and  
✓ Hive Removal

**24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL**

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.  
**Written Guarantee And Discounted Rates**

**CALL SANKET TRIVEDI - 647.339.3926**  
Government Licensed Structural Exterminator

# ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

## Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,  
છોલેપુરી, કટલેસ,  
ખાસ્તા ક્યોરી,  
સેવ ઉસળ, સમોસા ચાટ

## Takeout & Catering

Limited થાળી  
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી  
(without sweet & Farsan)

\$6.50 +Tax



## CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,  
Kathor, Puri, Dal, Rice  
Papad, Pickle, Kachumber

Franchise  
Opportunity  
in GTA

Call us for details

રસોઈકામ  
કરી શકે તેવા  
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી  
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ  
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

# ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,  
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine  
Special  
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



# મિસ યુ સો મય જાન: મહુવામાં 60 ફૂટના પુલ પરથી ફૂટી પ્રેમપંખીડાનો આપઘાત

સ્યુસાઈડ નોટ સોશિયલ મિડિયા પર મુકી બહેડારાયપુરાના યુવકનો આપઘાત

મહુવા

મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી બુધવારે બપોરે પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા ચક્રવાર મચી હતી. મહુવા તાલુકાના વેલણપુર ગામે બુધવારના રોજ ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે રહેતો 19 વર્ષીય યુવાન તેજસ બલ્લુભાઈ પટેલ વસારી જિલ્લાની 16 વર્ષીય સગીર પ્રેમિકા સાથે એક્ટિવા મોપેડ પર આવ્યા હતા. સ્યુસાઈડ નોટ લખી બપોરે 3 વાગ્યાના અરસામાં

વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી સગીર પ્રેમિકા સાથે ઝંપલાવ્યું હતું. અંદાજિત 60 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પથ્થર પર પડતા બંનેનું સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મૃતક સગીરા અને યુવાનના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોતાના લાડકવાયાને મૃત હાલતમાં જોઈ પરિવારજનોના આર્કંદ થી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પુલ પરથી ઝંપલાવી સ્યુસાઈડ કરતા પહેલા યુવાન પ્રેમીએ સ્યુસાઈડ નોટ સગીરાને ટેગ કરી સોશિયલ મિડિયા પર પણ અપલોડ કરી હતી. ઘટના સ્થળેથી પોલીસને સગીરાના મોબાઈલ પાછળ કવરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું અમે અમારી મરજીથી સ્યુસાઈડ કરતા છે અને મારી મમ્મીને અમારાથી બો પ્રોબ્લેમ છે સ્પેશિયલી મારાથી ઓલરેડી એને તો મને એવું કઈ જ દીધું હતું કે મરી જા એટલે અમે સ્યુસાઈડ કરી રહ્યા છે.

# બારડોલીના બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન થતા સાતને નવજીવન

હૃદય અર્જ ફેફસાના દાનની સાતમી ઘટના

બારડોલી: બારડોલી તાલુકાના ટીંબરવા (સાંકળી) ગામના 46 વર્ષીય બ્રેઈનડેડ થયેલાં કામિનીબેન પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસા, કિડની, લિવર અને યક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. દુ:ખભરી સ્થિતિમાં પટેલ પરિવારે પ્રેરણારૂપ નિર્ણય કરતાં અંગદાન દ્વારા અન્ય લોકોની જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કર્યો છે. સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મિનિટમાં, હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મિનિટમાં કાપી ઓર્ગન

ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

ટીંબરવા ગામના ટેકરા ફળિયામાં રહેતાં અને ખેતીવ્યવસાય કરતાં ભરતભાઈ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન તા.1૭ મે ના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયાં, પ્રયત્ન કરવાં છતાં ઉભા થવાયું ન હતું. પરિવારે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરતાં બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હોવાથી હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. જેથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

## કોરોનામાં પરિવારના 3 સભ્યો ગુમાવતા વૃદ્ધા નવમા માળેથી કૂદ્યા

સુરત: ભટારના ગાંધીકુટીર પાસે વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય ચન્દ્રકાન્તાબેન દિનેશભાઈ સોથાણીએ બુધવારે સવારે એપાર્ટમેન્ટના 9માં માળેથી નીચે ઝંપલાવ્યું હતું. તેમને ગંભીર ઈજા થતા મોતને ભેટ્યા હતા. કોરોનાની બીજી લહેરમાં ચન્દ્રકાન્તાબેનના લાડકવાયા એકના એક પુત્ર અરૂણ, તેમના ભત્રીજાની પુત્રવધુ તથા દિયરનું મોત થયું હતું. એટલું નહી પણ ચન્દ્રકાન્તાબેન કોરોના સંક્રમિત બન્યા હતા. આવા સંજોગોમાં ચન્દ્રકાન્તાબેન સતત માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હતું. ચન્દ્રકાન્તાબેન મુળ રાજસ્થાનના જયપુરના વતની હતા.

## સુરતના બે ભૂલકાઓએ સેવા કરવા વસાવ્યું ઓક્સિજન મશીન

સુરત: હાલ સુરતના સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. આ બાળકો કુંભારે પરિવારના હોવાની માહિતી છે. 9 વર્ષનો મયંક સુશીલ કુંભારે અને 6 વર્ષની શ્રુતિ સુરેશ કુંભારે પોતાના માતાપિતા પાસે ગિફ્ટમાં કોઈ રમકડાં નહિ માગ્યા પણ માગ્યું તો ઓક્સિજન મશીન. બંને બાળકોએ જણાવ્યું કે તેમણે સમાચારમાં ઓક્સિજનની અને વેન્ટિલેટરની અછત વિશે જોયું છે. તેથી તેઓએ નક્કી કર્યું કે શા માટે એક ઓક્સિજન મશીન ન ખરીદવામાં આવે. જેથી જો ભવિષ્યમાં કોઈ દર્દીને મદદ કરી શકે. આ વિચાર બાદ તેઓએ એક મશીન વસાવ્યું હતું.

## સલુનમાં કામ કરતી મિઝોરમની યુવતીની મગદલ્લામાં લાશ મળી

સુરત: મુળ મિઝોરમની વતની અને હાલમાં મગદલ્લા ગામમાં સુમન આનંદ આવાસમાં રહેતી 2૫ વર્ષીય આશા રામબહાદુર સારકીએ સલુનની દુકાનમાં કામ કરતી હતી. તેના પરિચિત વ્યક્તિએ રવિવારે આશાને ફોન કર્યો હતો પણ તેણે રિસીવ ન કરતા મંગળવારે બપોરે તેના ઘરે ગયા હતા. ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરમિયાન ફાયરબ્રિગેડ પણ આવી પહોંચી હતી. અને દરવાજો તોડીને ફાયર અને પોલીસ અધિકારી અંદર ગયા હતા. ત્યારે બેડરૂમમાં આશા મૃત હાલતમાં હતી. પોલીસ સુત્રોએ કહ્યું કે આશા અહીં ઘણા સમયથી એકલી રહેતી હતી.

## સરથાણા નેચરપાર્કમાં સર્પદંશથી 14 વર્ષની વાઘણ સાંભવીનું મોત

સુરત: સુરતના સરથાણા સ્થિત નેચરપાર્કમાં સર્પદંશ બાદ 14 વર્ષની વાઘણ (સાંભવી)નું પાય દિવસની સારવાર દરમિયાન આજે મળસ્કે 4 વાગ્યે મોત થયું છે. તેને ઈન્જેક્શન અને બોટલ ચડાવાયા હતા પણ જીવ બચાવી શકાયો નથી. વાઘ અને વાઘણની જોડી તૂટી છે. સુ ઈન્ચાર્જ ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે 4 થી જૂનના રોજ જ્યારે સ્ટાફ દ્વારા રૂટિન ચેક કરવામાં આવ્યું ત્યારે સાંભળવી સુસ્ત હાલતમાં બેઠેલી દેખાઈ હતી. તપાસ કરાતા તે નર્વસ સાઈન લકવાગ્રસ્ત જણાઈ હતી. જેથી તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

# THANK YOU FRONTLINE WORKERS



**MORTGAGE DILIGENT**  
A STEP AHEAD  
FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

**5 Yrs Fixed @ 1.84%\* High Ratio Only**  
**5 Yrs Variable @ 1.15%\* High Ratio Only**  
**3 Yrs Variable @ 0.99%\* (Special Promotion)**



**Rakesh Patel\*\***  
Vice President- Commercial.



**Pranay Jani \***



**Nilesh Tailor \***



**Bala Shah\***



**Vijay Rana\***



**Rajesh Khurana, MBA**  
Principal Broker

**Cell : 416-616-1300**

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.\* FSCO#10252,OAC,E&O.E \* - Mortgage Agent, \*\* - Vice President

\* Some conditions apply

# મોરબીમાં મહિલા સાથેના વીડિયોથી વ્લેકમેલ કરાતા મહંતનો આપઘાત

રાજકોટ

રાજકોટ મોરબી રોડ પરના ખોડીયાર આશ્રામના મહંત જયરામદાસબાપુના અપમૃત્યુના કેસમાં અંતે મહંતને આપઘાત કર્યો હોવાની થીયરી ઉપર કુવાડવા પોલીસે સ્યુસાઈડ નોટ આધારે મંદિરના ટ્રસ્ટીની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે મરવા મજબુર કરવા અંગે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. ભત્રીજો, જમાઈ સહીત ત્રણ શખ્સોએ મહંતનો મહિલા સાથે વિડીયો બનાવી વ્લેકમેલ કરી પૈસા પડાવી, મારકૂટ કરતા હોવાનું સ્યુસાઈડ નોટમાં જણાવાયું છે. ૬ પૈકી ૧ વિડીયો પોલીસને મળ્યો છે.



ફરિયાદ નોંધાવી છે. આ અંગે ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટના આપઘાતની છે. ત્રણેય આરોપીઓ જેમાં હિતેશ મહંતનો ભત્રીજો છે અને અલ્પેશ જમાઈ છે જ્યારે વિક્રમ તેઓનો સાગરિત છે ૩૦ તારીખે વિક્રમ સાથે ઝઘડો થયો હતો અને મહંત સાથે મારકૂટ પણ થઈ હતી ત્રણેય શખ્સોએ દોઢ વર્ષ દરમિયાન મહંત પાસે કોઈ મહિલાને મોકલી તેમની સાથેના આપત્તિજનક વિડીયો બનાવી લીધા હતા અને આ વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી મહંતને ત્રાસ આપતા હતા ત્રિપુટીએ મહંતને વ્લેકમેલ કરી ૫૦ હજાર રોકડા અને એક કાર પણ પડાવી લીધા હતા ડીસીપી મીણાએ વધુમાં જણાવ્યું હતું કે આવા છ વિડીયો આ લોકોએ બનાવ્યા છે જે પૈકી હાલ એક વિડીયો પોલીસ પાસે આવ્યો છે આ ત્રિપુટીએ કોઈ બારી પાસે ફેન રાખીને વિડીયો બનાવ્યા છે જેથી આ વિડીયો આશ્રામમાં જ ઉતારવામાં આવ્યા છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી.

## એકતા અને અનુશાસન : સૌરાષ્ટ્રની ૪૮ કોલેજોમાં NCC વૈકલ્પિક વિષય

રાજકોટ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તમામ વિશ્વ વિદ્યાલયોમાં નેશનલ કેડેટ્સ કોર્પસ (એનસીસી) ને પણ સામાન્ય વૈકલ્પિક વિષય તરીકે લાગુ કરવાની સૂચના આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આ જ શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરવા પ્રયત્ન આદર્યો છે. એકેડેમિક કાઉન્સિલની આગામી બેઠકમાં આ મુદ્દો મૂકાશે, અને બધુ ધારણા મુજબ પાર ઉતરે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પૈકી કમ સે કમ ૪૮ માં હવે એનસીસી પણ એક વિષય તરીકે ભણાવીને માર્કશિટમાં તેના માર્ક પણ લખાશે. 'એકતા ઓર અનુશાસન' એવું સ્લોગન ધરાવતા એનસીસીમાં હાલ હજારો કેડેટ્સ છે, જેઓ શિસ્ત સાથે રાષ્ટ્રીયતાના પાઠ પણ ભણી રહ્યા છે. અત્યારે જેમ હિન્દી, સંસ્કૃત વગેરે વૈકલ્પિક વિષયો છે તેમ એનસીસી પણ આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે.

# રેલવે જમીનનો વિવાદ: કોંગ્રી MLAનું પોલીસ મથકમાં ઉપવાસ આંદોલન

અમરેલી

અમરેલીના રાજુલામાં રેલવે વિભાગની રેલ્વે સ્ટેશનની જમીન માટે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. રાજુલા નગરપાલિકા દ્વારા ખાલી પડી રહેલ આ જમીનની માગ કરવામાં આવી છે. પણ રેલ્વે વિભાગ દ્વારા જમીન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. અને ગત રોજ રેલ્વે વિભાગ દ્વારા જમીન પર ફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનો નગરપાલિકાના કોંગ્રીના સભ્યો અને ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા વિરોધ કરાયો હતો.

જમીન પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને ચુસ્ત બંદોબસ્ત સાથે રેલ્વે વિભાગ દ્વારા ફેન્સિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને આજે પણ વિરોધના પગલે અમરીશ ડેરની પોલીસે અટકાયત કરી હતી. અને બાદમાં અમરીશ ડેર દ્વારા પોલીસ મથકમાં જ ઉપવાસ આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું હતું. અને જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે તેવી જાહેરાત પણ અમરીશ ડેરે પોલીસ સ્ટેશનથી કરી હતી. અને કોરોનાને કારણે અન્ય લોકોને ન આવવા માટે પણ અપીલ કરી હતી.

## પોરબંદરનું વહાણ ઓમાનના દરિયામાં ડુબ્યું

પોરબંદર : કચ્છ વહાણવટી એશો.ના આદમભાઈ સિધિકભાઈ થૈમ તેમજ આદમભાઈ કરીમભાઈ ધોબીએ જણાવ્યું હતું કે, પોરબંદરની યુરો એરિયન શીપીંગ કંપનીની માલીકીનું અમૃતા નામનું વહાણ તા.૩૦.૫ના રોજ જનરલ કાર્ગો ભરીને યમનની આશશીર બંદર તરફ જવા માટે રવાના થયું હતું. જેમાં ૯ ખલાસી સવાર હતાં. દરમિયાન તા.૨.૬.૨૧ ના રોજ ઓમાનના રાસલહાદ અને મશીરા વચ્ચે પહોંચતા વહાણે દરિયામાં જળસમાધિ લીધી હતી. સદભાગ્યે તેની પાછળ આવી રહેલા દુબઈના વહાણ ફનેહ અલબારીએ ખલાસીઓને મહામહેનતે બચાવી લીધા હતાં. જે તમામ ખલાસીઓ ઓમાનના સૌર બંદરે ઉતર્યા છે.

# જામનગરમાં બેરોજગાર પતિનું કારસ્તાન શિક્ષિકા પત્નીની સરાજાહેર નિર્મમ હત્યા

જામનગર

જામનગરમાં બુધવારે સંવારે આઠેક વાગ્યા આસપાસ કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે નીતાબેન પ્રફુલભાઈ ડાભી (ઉ.વ. ૪૦) નામની મહિલાને આંતરી લઈ તેના જ પતિએ હુમલો કરી છરીના બે ત્રણ ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. પતિના એકાએક હુમલાથી લોહીના ખાબોચિયા વચ્ચે ઢળી પડેલ મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો.

ગુલાબનગર વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ સામેના વૃંદાવન સોસાયટીમાં રહેતી મહિલા થાવરિયા ખાતે શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે ગુલાબનગરથી તેણીની શાળાએ જવા નીકળી હતી. ત્યારે મહાપ્રભુજીની બેઠક પાસે તેના જ પતિએ આંતરી લઈ તેણીની કરપીણ હત્યા નીપજાવી હતી. હત્યાને અંજામ આપી પતિ તાત્કાલિક સ્થળ છોડી નાશી ગયો હતો.

## ભુજમાં ધોળા દહાડે પોલા છ લાખની લૂંટ

ભુજ: શહેરના લખુરાઈ ચાર રસ્તા નજીક યુવાનને છરી ઝીંકીને ૫.૭૦ લાખની લૂંટ ચલાવાયાની ઘટનાને પગલે ચક્રચાર મચી ગઈ છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ભુજની જૂની રાવલવાડીમાં રહેતા યુવાન સાથે બનાવ બન્યો હતો. યુવાન કંપનીમાં કલેક્શન કરતો હતો. અને પોતાની સાથેની બેગમાં રૂ. ૫,૭૦,૨૧૩ની રકમ લઈને જાણીયાઈ સી નજીકથી પસાર થતો હતો તે દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેને અટકાવીને પ્રાથમવાર છરી મારવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાન દૂર થઈ જતા બચી ગયો હતો તેથી બીજી વખત કરાયેલા હુમલામાં ભોગવતને હાથમાં છરી લાગી હતી. આરોપીઓએ હિરેનને છરી ઝીંકીને તેની પાસેની બેગમાં રહેલા રૂ. ૫.૭૦ લાખની લૂંટ ચલાવીને પોતાની બાઈકમાં નાશી ગયા હતા.

સિંહ દર્શનને લીધે આજે આ પરિવારની આર્થિક હાલત એકદમ નબળી બની ગઈ છે, પરિવારનું ગુજરાન ચલાવવા અહીના જીપ્સીના ડ્રાઈવરો, ગાઈડોને ના છુટકે મજૂરી કરીને જે મળે તેમાંથી ઘરનું ગુજરાન ચલાવવું પડે તેવી નોબત આવી છે. સાસણના સરપંચ જુમ્માભાઈ કટિયાએ જણાવ્યું કે, સાસણ એક એવું ગામ છે, ત્યાના લોકો સમગ્ર વિશ્વને સિંહ બતાવવાનું કામ કરે છે.

# સાસણ બેરોજગારીના બપ્પરમાં, 400 જીપ્સી ડ્રાઈવર-ગાઈડની દશા જાણીને દયા આવશે !

જૂનાગઢ

સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો માટે જગવિખ્યાત સાસણ કોરોનાને લીધે સિંહદર્શન બંધ હોવાથી બેરોજગારીના બપ્પરમાં ધસી ગયું છે, 400ની વસ્તીના નાના એવા સાસણ ગામના 400 પરિવારો માત્ર માત્ર સિંહ દર્શનથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં કોરોનાને લીધે અનેકવાર બંધ કરાયેલ

સિંહ દર્શનને લીધે આજે આ પરિવારની આર્થિક હાલત એકદમ નબળી બની ગઈ છે, પરિવારનું ગુજરાન ચલાવવા અહીના જીપ્સીના ડ્રાઈવરો, ગાઈડોને ના છુટકે મજૂરી કરીને જે મળે તેમાંથી ઘરનું ગુજરાન ચલાવવું પડે તેવી નોબત આવી છે. સાસણના સરપંચ જુમ્માભાઈ કટિયાએ જણાવ્યું કે, સાસણ એક એવું ગામ છે, ત્યાના લોકો સમગ્ર વિશ્વને સિંહ બતાવવાનું કામ કરે છે.

# Imperial

## PEST CONTROL

Residential • Commercial • Industrial

**24 Hour Service • 7 Days a Week**

Preventing the Spread of COVID-19 :  
Our disinfectant services that we offer are:

**1** Spray Services

**2** Fogging Services

**3** Sanitation Services

All Pest Control:  
Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.  
Total Interior & Exterior Pest Control

Removal:  
Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca  
info@imperialpestcontrol.ca  
(We speak English, हिन्दी, ગુજરાતી)

**Call: Ramesh Kanani 416-837-1820**

**સ્વદેશ**  
CANADA

Registration # 869127209  
Publication Mail Agreement /  
Email : info@swadesh.news

**WWW.SWADESH.NEWS**

Return Undeliverable Canadian Address To :

**Shree Balaji Inc.**  
MAILING ADDRESS  
23 Lyric Road,  
Brampton ON L6S 0B4.  
416-996-7755

Registered Address  
713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi	Designed By Sabir Daroga
Director : Nilesh Tailor	
Sub Editor : Chhaya Gandhi	Mevada Piyush
Montreal Bureau : Vijay Patel (514-826-7442)	
GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT ( INDIA)	Firoz Shaikh

Disclaimer : Swadesh is a weekly newspaper published by Shree Balaji Inc. in Gujarati Language. The opinions expressed in Swadesh may not be those of the publisher. Contents of this publication are covered by copyright and offenders will be prosecuted under the law.







## કરીના કપૂરને સીતાના રોલ માટે ઓફર કરાઈ

મુંબઈ : સિનેમા જગતમાં એક સમયે માતા બબ્લા પછી અભિનેત્રીઓની ડિમાન્ડ ઓછી થઈ જતી હતી. જોકે કરીના કપૂરે પોતાની સાથે આમ બિલકુલ થવા દીધું નથી. રામાયણ ધાર્મિક ગ્રંથની મૂળ કહાણીમાંથી ફક્ત સીતાના પાત્ર પર ફિલ્મ બનાવવાની ઘોષણા થઈ છે. આ પછી સીતાનું પાત્ર કોણ ભજવશે તેની ચર્ચા થઈ રહી છે. જોકે આ ચાલીમાં કરીના કપૂરનું નામ પણ સામેલ છે. કહેવાય છે કે, કરીનાનો સીતાના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે.



# સ્વદેશ

## કંગના પાસે કામ નથી, 50 ટકા ટેક્સ બાકી હોવાની પણ કરી કબૂલાત



પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી બોલીવૂડ એક્ટ્રેસ કંગના રાનીતે હવે પોતાની કેરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કંગનાનું કહેવું છે કે, મેં ગયા વર્ષનો અડધો ટેક્સ ભર્યો નથી. કારણકે મારી પાસે હાલમાં કોઈ કામ નથી. પહેલી વખત એવું થયું છે કે, મારે ટેક્સ ભરવામાં મોડું થયું હોય. કંગનાએ આ અંગેનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો હતો. તેણે કહ્યું તુ કે, હું મારી આવકના 45 ટકા ટેક્સ તરીકે ચૂકવું છું અને સોથી વધારે ટેક્સ ભરનારા લોકોની કેટેગરીમાં આવતી હોઉં છું. જોકે મારી પાસે હાલમાં કોઈ કામ નહીં હોવાથી ગયા વર્ષનો 50 ટકા ટેક્સ ચૂકવવાનો મારે બાકી છે. ટેક્સ ભરવામાં મોડું થયું હોય તેવું પહેલી વખત બન્યું છે પણ સરકાર મારે જે ટેક્સ ભરવાનો બાકી છે તેના બાલનની ખુબ પર વ્યાજ પણ રાહ જોવાઈ રહેલી ફિલ્મ ચાર્જ કરી શેરની અઢારમી જુને ભારત રહી છે. સહિત ૨૪૦ દેશોમાં એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. જેમાં વિદ્યા બાલન ઇમાનદાર મહિલા ફોરેસ્ટ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળશે. ટ્રેલર લોકોને ખુબ ગમ્યું છે. વિદ્યા કહે છે-મેં પહેલીવાર શેરનીની કહાની સાંભળી હતી ત્યાં જ મને એ આકર્ષક અને

## અદ્ભૂત કહાની જોવા મળશે: વિદ્યા બાલન

દિલચ્છપ લાગી હતી. ફિલ્મમાં સંવેદનશીલ વિષય છે. મનુષ્ય અને પશુ નહિ પણ મનુષ્ય-મનુષ્ય વચ્ચેની સમાનતા, આંતરીક



## મેં રાહ જોઈ અને સફળ થઈ : પરિણિતી ચોપરા

પરિણિતી ચોપરાએ પોતાના કામથી ઈન્ડસ્ટ્રીમાં નામ જાળવી પુરાવ્યું છે. તે સતત વ્યસ્ત રહેતી અભિનેત્રીના લિસ્ટમાં સામેલ છે. અમુક ફિલ્મોને કારણે તેની અભિનય ક્ષમતા પર સવાલો થયા હતાં. પરિણિતી કહે છે કે મારી કેટલીક ફિલ્મો સારી ચાલી નહોતી. પરિ કહે છે એવા કેટલાય અભિનેતા-અભિનેત્રીઓ છે જેમનામાં ભરપુર ટેલેન્ટ હોય છે. પરંતુ તે દેખાડવા માટે સારી સ્ક્રિપ્ટ તેમને નથી મળતી. એ ખરેખર કમનસીબી કહેવાય. જોકે મારી સાથે કંઈક અલગ જ થયું હતું. મેં જ્યારે શરૂઆત કરી તો મને સારી ફિલ્મો મળી હતી. મને અવોર્ડ્સ પણ મળ્યા હતા. પણ પછી અમુક ફિલ્મો ન ચાલતાં મારી અભિનય ક્ષમતા પર સવાલ શરૂ કરવામાં આવ્યા હતા. પણ મેં રાહ જોઈ અને પછી હું સફળ થઈ.



સમજણ અને કરવામાં આવ્યા હતા. સહઅસ્તિત્વની વાત છે. પછી મેં રાહ જોઈ અને પછી હું સફળ થઈ. નિર્દેશક અમિત માસુરકર કહે છે આ ફિલ્મની સમગ્ર ટીમ સાથે કામ કરવાનો અનુભવ અદ્ભૂત રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના લોકો સુધી અમારી આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મથી પહોંચશે. નિર્માતા ભુષણ કુમાર અને વિક્રમ કહે છે આ એવી ફિલ્મ છે

જે આજના સમયની જરૂરિયાત છે, અપરંપરાગત એવી પ્રેરક કહાનીને રજૂ કરવી એ ગૌરવરૂપ છે.

**PayLessTravel**  
Fly Well ... Pay Less

**વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ**

**Call for all your Air Travel Services**

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

**Call us for the Lowest Fares Coming From India to Canada Also**

**Please Call 905-281-2627**

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time

**GRAND CENTRAL MIMICO**  
(South Tower)

**Guaranteed Access** to this prestigious project.

Located at Royal York Rd & Evans Ave in Etobicoke! Grand Central Mimico will feature direct access to the Mimico GO Station,

Starting from **\$500's**

**Century 21**  
Nadir Shah MBA  
Sales Representative

**416.625.3580**  
nadir.shah@sympatico.ca

**CENTURY 21**  
Regal Realty Inc. Brokerage  
Member Brooker  
4030, Sheppard Ave. East, Toronto,  
ON M1S 1S6 T: 416.291.0929 (24/7)  
F: 416.291.0984

Not intended to solicit buyers or sellers already under a contract



હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા ક્લેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી  
અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર શાણેશાણ માણો !!રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, સ્મતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ,  
પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.

5G નેટવર્ક આવ્યા બાદ ઇન્ટરનેટની સ્પીડ 4G નેટવર્ક કરતા 20 ગણી વધી જશે

# 5G ટેકનોલોજી : સુવિધા સાથે સુરક્ષાને જોખમ

ભારતમાં 5G ટેકનોલોજીનું આગમન ટુંક સમયમાં જ થવાનું છે. આ પહેલાં આ નવી ટેકનોલોજીને લઈને વિવાદ ઊભો થયો છે. 5G ટેકનોલોજી માનવી, પ્રાણીઓ અને પર્યાવરણ પર વિપરિત અસર કરશે એવા દાવા તો પહેલાથી જ થતા હતા. જ્યારે ગત અઠવાડિયે અભિનેત્રી જૂહી યાવલાએ ભારતમાં 5G નેટવર્ક સ્થાપવા પર મનાઈ ફરમાવવા દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરતા દેશમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જૂહી યાવલાનું માનવું છે કે, 5G ટેકનોલોજીથી માણસો, પ્રાણીઓ અને ધરતીને મોટું નુકસાન થશે. તેમનું કહેવું છે કે જો 5G નેટવર્ક આવ્યું તો કોઈ પણ તેના રેડિએશનથી બચી નહીં શકે. જૂહી યાવલાનો દાવો છે કે 5G ટેકનોલોજીથી હાલ કરતા 10થી 100 ગણું વધારે રેડિએશન ફેલાશે.

જો કે, અદાલતે કોઈ આધાર-પુરાવા વગર કરાયેલી આ અરજીને ફગાવી દઈને જૂહી યાવલાને 20 લાખનો દંડ ફટકાર્યો હતો. હવે સૌએ 5G ટેકનોલોજીને સમજવું પડશે. 2G, 3G અને 4G બાદ ઇન્ટરનેટની દુનિયા હવે 5Gની ગતિ સાથે કામ કરશે. 5G નેટવર્ક આવ્યા બાદ ઇન્ટરનેટની સ્પીડ 4G નેટવર્ક કરતા 20 ગણી વધી જશે. અત્યારે ચાલી રહેલા 4G નેટવર્કની મહત્તમ સ્પીડ 45 મેગાબાઈટ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ) રેકોર્ડ થઈ છે. જ્યારે 5G નેટવર્કમાં આ સ્પીડ 1 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડ (જીબીપીએસ) જેટલી થઈ જશે. 1 ગીગા બાઈટમાં 1024 મેગા બાઈટ હોય એ હિસાબે અઢી કલાકની હાઈ ક્વોલિટી ફિલ્મ માત્ર એક સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે. 5G નેટવર્ક આવ્યા બાદ દુનિયા અભૂતપૂર્વ ઝડપથી દોડવા લાગશે તેવો દાવો થઈ રહ્યો છે. 3G નેટવર્કના ઉદય સાથે મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગની શરૂઆત થઈ હતી.

મોબાઈલ ફોન સ્માર્ટફોન બની ગયો. સ્માર્ટફોન પર વેબસાઈટ્સ ખૂલવા લાગી, મેસ ટેબાવા લાગ્યાં. એસએમએસ સુધી સીમિત 2Gની દુનિયા અદૃશ્ય થવા લાગી. એ પછી હાઈસ્પીડ પ્રોસેસિંગ ચીપની ઉત્ક્રાંતિ થઈ અને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પર સવાર થઈને 4G નેટવર્ક આવી પહોંચ્યું. ટેકનોલોજીની દુનિયામાં આ મોટી છલાંગ હતી. સ્માર્ટફોન અને ટેબ્લેટમાં વાયરોના લાંબા ગૂંચળા વગર જ હાઈસ્પીડ ડેટા ટ્રાન્સફર થવા લાગ્યો હતો. હાઈસ્પીડ ડેટા ટ્રાન્સફરના કારણે નેવિગેશન, મેસેજિંગથી લઈને બીજી અસંખ્ય કામગીરી માટે એપ્સ ઉપલબ્ધ બની. સૌથી ઝડપી 4G નેટવર્ક ઉપર સરેરાશ 45 એમબીપીએસ સ્પીડ નોંધાય છે. ટેલિકોમ માંધાતાઓને આ સ્પીડ વધારવાની



અપેક્ષા હતી. પરંતુ દુનિયાભરમાં સ્માર્ટફોનની વધી રહેલી માંગના કારણે 4G નેટવર્ક ઓવરલોડનો શિકાર બની ગયું છે. 5G નેટવર્ક આ સમસ્યાના ઉકેલ તરીકે જ બજારમાં આવી રહ્યું છે. એક્સપર્ટ્સ હવે 5G નેટવર્કમાં ઇન્ટરનેટની સ્પીડ 1000 એમબીપીએસ સુધી પહોંચાડવા ધારે છે.

ટેલિકોમ કંપનીઓ ઉપરાંત બીજા અનેક વ્યવસાયોમાં 5G ટેકનિક અનેક રીતે મદદરૂપ સાબિત થશે. ટેકનોલોજીની દુનિયામાં હાલ સેલ્ફ ડ્રાઈવ કાર એટલે કે ડ્રાઈવર વિના જાતે ચાલે એવી કારથી લઈને રોબોટ અને ડ્રોનના વિકાસ પર કામ ચાલી રહ્યું છે. 5G નેટવર્ક આવ્યા બાદ આ ક્ષેત્રોમાં ભારે પ્રગતિ સાંધી શકાશે. 5G નેટવર્કની મદદ વડે સેલ્ફ ડ્રાઈવ કાર રિયલ ટાઈમ ટ્રાફિકનો ડેટા મેળવી શકશે અને ભીડભાડભરી

**પ્રાસંગિક**  
**ધવલ શુક્લ**

**દુનિયાના કેટલાક સંશોધકોએ આ નવી ટેકનોલોજીને કારણે રેડિયેશનનો ખતરો વધવા સાથે પશુ-પક્ષી, વૃક્ષો અને માનવજાતને મોટું નુકસાન થવાનો ભય સેવ્યો**

સડકો પર જાતે જ ઝડપથી માર્ગ કાઢી શકશે. આજે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ઓટોનોમસ મશીન એટલે કે, માનવીની મદદ વિના જાતે જ કામ પાર પાડી દેતા મશીનોનો વપરાશ વધ્યો છે, એમાં પણ 5G નેટવર્ક આવ્યા બાદ વધારે સારા પરિણામો પ્રાપ્ત થશે. એક અંદાજ મુજબ 5G નેટવર્ક આવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 565 અબજ

ડોલરની વૃદ્ધિ થશે. આટલો જંગી લાભ ખાટવા માટે અનેક દેશોમાં પરસ્પર પ્રતિસ્પર્ધા વધી રહી છે. શરૂઆતમાં તો 5G નેટવર્ક ઉચ્ચ ગુણવત્તાના જીવંત પ્રસારણને સક્ષમ બનાવશે. જેના કારણે ઇન્ટરનેટ ઉપર લાઈવ સ્પોર્ટ્સ જોવાની મજા પડી જશે. તો ક્લાઉડ ગેમિંગમાં રસ ધરાવતા લોકો માટે પણ 5Gનો અનુભવ અદભૂત સાબિત થશે. આ ઉપરાંત મેપિંગ અને શોપિંગ એપ્સમાં પણ ગજબનો સુધારો જોવા મળશે. દૂરથી થતી સર્જરી તેમજ હોલોગ્રાફિક વીડિયો કોલ્સની સેવાને પણ 5G નેટવર્ક બહેતર બનાવશે. જાણકારોના મતે 5G નેટવર્કની બીજી પેઢીના ફોન હજુ આવતા વર્ષે બજારમાં આવશે. જેમાં ખામીઓ સુધારી લેવામાં આવશે. વર્ષ 2023 સુધીમાં મોબાઈલ બજારમાં 5Gની ટકાવારી 20 ટકાએ પહોંચવાનું

પણ 5G નેટવર્ક બહેતર બનાવશે. જાણકારોના મતે 5G નેટવર્કની બીજી પેઢીના ફોન હજુ આવતા વર્ષે બજારમાં આવશે. જેમાં ખામીઓ સુધારી લેવામાં આવશે. વર્ષ 2023 સુધીમાં મોબાઈલ બજારમાં 5Gની ટકાવારી 20 ટકાએ પહોંચવાનું

અનુમાન છે. શરૂઆતમાં જ ગ્રાહકોએ 5G સ્માર્ટ ફોનમાં ભારે રસ લેવાનું શરૂ કરી દીધું છે અને મોબાઈલ કંપનીઓને લોકોનો આ ઉત્સાહ હજુ વધવાની આશા છે. જોકે મોટા સ્ક્રીન અને ઉચ્ચ ગુણવત્તાના કેમેરાના કારણે 5G સ્માર્ટફોનની કિંમત ઘણી જ વધારે છે. જેમ જેમ 5G નેટવર્કનો વપરાશ વધતો જશે

તેમ તેમ સ્માર્ટફોનની કિંમતો પણ ઓછી થશે. મોબાઈલ કંપનીઓ નવી ટેકનિક વિશે એકબીજાથી ચડિયાતા દાવા કરી રહી છે. જો કે, 5G સ્માર્ટફોન ખરીદનારા લોકોએ પણ દુનિયાના દરેક ખૂણે 5G નેટવર્ક પહોંચી ન જાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

એક અંદાજ મુજબ 5G નેટવર્ક આવ્યા બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 565 અબજ ડોલરની વૃદ્ધિ થશે. આટલો જંગી લાભ ખાટવા માટે અનેક દેશોમાં પરસ્પર પ્રતિસ્પર્ધા વધી રહી છે. ચીન અને અમેરિકા વચ્ચે 5G ટેકનિકને લઈને ચાલી રહેલી રેસે એકબીજા માટે કડવાશ વધારી છે. અમેરિકાએ પોતાના ટેલિકોમ ઓપરેટરોને 5G સેવાઓ માટે ચીની કંપનીઓની મદદ ન લેવા આદેશ આપ્યો છે. આ માટે સુરક્ષાના કારણો રજૂ થઈ રહ્યા છે. જો ચીની કંપનીઓના સ્માર્ટફોન વપરાય તો તેમની પહોંચ અમેરિકાના 5G નેટવર્ક સાથે જોડાયેલા તમામ ક્ષેત્રો સુધી બની જાય. જે અમેરિકાની આંતરિક સુરક્ષા માટે ખતરાસમાન છે. હકીકતમાં 5G નેટવર્કમાં સુરક્ષાને લઈને જે સવાલ થઈ રહ્યાં છે એ ગેરવાજબી પણ નથી. સૈદ્ધાંતિક રીતે સંચાર માધ્યમો માટે મહત્વપૂર્ણ ટેકનિક પર નિયંત્રણ હોવાનો અર્થ છે કે ઓપરેટર જાસૂસી કે સંચાર માધ્યમોનું સંચાલન અવરોધી શકે છે.

ભારતમાં હાલ 4G નેટવર્કનો વપરાશ થાય છે અને સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા મોટાભાગના લોકો 4G નેટવર્કના ભરોસે છે. જોકે ભારતીય ટેલિકોમ ઓપરેટરો પણ દેશમાં 5G સેવા શરૂ કરવા થનગની રહ્યાં છે. જો કે, આ ટેકનોલોજીને લઈને જે ચિંતા વ્યક્ત થતી રહી છે. ભારતના અનેક વિજ્ઞાનીઓએ 5G ટેકનોલોજીને લઈને ઉતાવળ ન કરવાની સલાહ આપી છે. બે વર્ષ પહેલા કેટલાંક વિજ્ઞાનીઓએ સરકારને પત્ર લખીને 5G ટેકનોલોજીથી માનવીના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થવાનો અંદેશો વ્યક્ત કર્યો હતો. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, 5G અંગે વ્યાપક રિસર્ચની જરૂર છે. કારણ કે, રેડિએશનની અસરો લાંબા સમયે ખ્યાલ આવે છે. તેમનું માનવું છે કે, કદાચ 5G ટેકનોલોજી માનવીને નુકસાન ન કરે તો પણ વનસ્પતિઓને નુકસાન કરી શકે છે.

જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે, 5G નેટવર્કથી જે રેડિએશન ફેલાય છે એ 3.5 GHZ જેટલું હોય છે. આ પ્રમાણ અત્યારે મોબાઈલના ટાવરથી જે રેડિએશન ફેલાય છે એના જેટલું જ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના રિસર્ચમાં વાયરલેસ ટેકનોલોજીથી સ્વાસ્થ્ય પર વિપરિત અસરો થવાના પ્રમાણ મળ્યા નથી.



**SHARP**  
INTERNATIONAL  
IMMIGRATION SERVICES



**AMI MEHTA**  
IMMIGRATION PRACTITIONER

# CANADA IMMIGRATION

**GOOD NEWS FOR RECENTLY  
GRADUATED STUDENTS  
INSIDE CANADA**

**STUDENTS UNDER POST GRADUATION WORK  
PERMIT WITH IELTS 5 BAND CAN QUALIFIED  
TO APPLY FOR PERMANENT RESIDENCY  
RIGHT AWAY !!**

Effective May 6, 2021, Immigration, Refugees and Citizenship Canada (IRCC) will begin accepting applications under the following 3 streams:

**20,000**

applications  
for temporary  
workers in  
health care

**30,000**

applications for  
temporary  
workers in other  
selected essential  
occupations

**40,000**

applications for  
international  
students who  
graduated from a  
Canadian  
institution

**FIRST COME FIRST  
SERVE BASIS !!**

**CONTACT US IMMEDIATELY**

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE  
/ PR 90 DAYS INSURANCE**

**BUSINESS IMMIGRATION  
TO CANADA REQUIRES  
3 CR NET WORTH/  
1.5 CR INVESTMENT/  
BUSINESS OWNERSHIP/  
MANAGEMENT EXP**

**REJECTED  
CASES WELCOME**

**ONLINE IELTS  
SPOKEN ENGLISH  
CLASSES ON ZOOM**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS  
WORLD MALL, BRAMPTON, ONT

**416-745-2466  
905-230-7855**

2/A WAGHESHWARI SOC,  
VADODARA GUJARAT INDIA

**91-9428973911  
91-9512157817**

Email.: [info@siis.ca](mailto:info@siis.ca)

Website.: [www.siis.ca](http://www.siis.ca)



## શરીરમાં ઇમ્યુનિટી વધારશે આ વસ્તુ

ઇમ્યુનિટી સારી હશે તો કોરોના અનલ્લેક ફંગસથી પોતાની રક્ષા કરી શકાશે. તેથી રોજિંદા જીવનમાં ચોક્કસ ખાદ્ય પદાર્થોને સામેલ કરવા જરૂરી છે. શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન્સ મહત્વનો ભાગ ભજવે છે. તેથી આપણે એવા ફૂડનું સેવન કરવું જોઈએ જેમાં વિટામિન્સ વધારે હોય.



**સંતરા :** એક મધ્યમ આકારનું એટલે કે ૧૦૦ ગ્રામ વજન ધરાવતા સંતરામાં વિટામિન સીની માત્રા ૫૩.૨ મિલીગ્રામ જેટલી હોય છે. સાઇટ્રિક્યુક્ત ફળોમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો સમાયેલા છે જે આપણી રોગ પ્રતિરોધક શક્તિને વધારે છે.

**અનાનસ :** રોજ અનાનસનું સેવન કરવાથી વાયરલ અને બેક્ટેરિયલ બંને સંક્રમણોની શક્યતા ઘટી જાય છે. પાચનેપલમાં વિટામિન સી અને મેગ્નીઝ પ્રચુર માત્રામાં સમાયેલા છે. ઉપરાંત તેમાં કેલ્સી ઓછી હોય છે. તેમજ સાઇટ્રી ફાયબર અને ઓમલેન પણ હોય છે.

**આમળા :** આમળામાં પ્રચુર માત્રામાં વિટામિન સી મસાચેલું હોય છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે. જે રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળાના સેવનથી મેટાબોલીઝમ સુધરે છે તેમજ સાઇટ્રી મજબૂત થાય છે.

**લીંબુ :** વિટામિન સીનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં થિયામિન, રાઇબોફ્લેવિન, વિટામિન બી ૬, પેન્ટોથેનિક એસિડ, કોપર, મેગ્નીઝ સમાયેલા છે. લીંબુમાં સમાયેલા એન્ટીઓક્સિડન્ટ કોશિકાઓને નુકસાન પહોંચાડી ઇન્ફેક્શન કરતા ફી રેડિકલ્સને દૂર કરે છે.

## બીમારીથી દૂર રહેવા ખાલી પેટ આ મસાલોઓનું સેવન ન કરવું

**તજ :** તજ રોજિંદા આહારમાં સ્વાદ વધારવાની સાથેસાથે ઓષધીય ગુણ માટે પણ જાણીતું છે. પરંતુ તેનું વધુ પડતું સેવન હાનિકારક છે. તજનું વધુ પડતું સેવન લીવર પર આડ અસર કરે છે. મુખમાં છાલા થાય છે. મુખમાં સફેદ ઘાબા તેમજ ખંજવાળ આવવાની તકલીફ થાય છે.


**મેથી :** નયણા કોઠે પલાળેલી મેથી ઘણા લોકો ખાતા હોય છે. પરંતુ જેમને શ્વાસ સંબંધી તકલીફ હોય તેમણે ખાલી પેટે મેથીનું સેવન કરવું નહીં. આ રીતે મેથી ખાવાથી અસ્થમાની તકલીફ વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પેટના નીચેના હિસ્સામાં દુખાવો પણ થઈ શકે છે.

**અજમો :** પેટની બીમારી માટે અજમો રામખાણ ઇલાજ છે. વજન ઘટાડવા માટે પણ તે મદદગાર સાબિત થયો છે. પરંતુ તે એક ગરમ મસાલો હોવાથી તેના વધુ પડતા સેવનથી દૂર રહેવું જ સલાહભર્યું છે. ખાસ કરીને નયણા કોઠે અજમો ખાવાથી છાતીમાં બળતરા થવાની શક્યતા રહે છે. સવારના શરીર તેમજ મગજને તાજગીસભર રાખતા નુસખા શરીર તેમજ મગજને ફીલ ગુડ કરવા માટે ચોક્કસ ટિપ્સ રોજિંદા જીવનમાં અપનાવી જોઈએ.

**કાળા મરી :** કાળા મરીનું ખાલી પેટ સેવન કરવાથી અમુક દવાઓનો પ્રભાવ ઓછો થઈ જવાનું અનેક સંશોધનમાં જણાવામાં આવ્યું છે. નયણા કોઠે કાળા મરીનું સેવન કરવાથી દવાઓનું સિએકશન તેમજ એલર્જી થવાની શક્યતા રહે છે.

**લાલ કેસિકમ :** રોજિંદા આહારમાં પેપ્ટિકાનો ઉપયોગ વધુ થઈ ગયો છે. જે લાલ રંગના શિમલા મરચાનો સુકો પાવડર છે. આ મરચાનો ઉપયોગ ખાલી પેટ કરવો નહીં. સલાડમાં લાલ શિમલા મરચાની બદલે લીંબુ નાંખવાની વધુ ફાયદો થાય છે.

## વિવાદિત એપ ટીક-ટોકની નવી ચાલ



લોકપ્રિય શોર્ટ વિડીઓ શેરીંગ એપ ટીક-ટોકએ છુપી રીતે તેની પ્રાઇવસી પોલીસી અપડેટ કરી. આ પોલીસી USAના યુઝર્સ માટે અપડેટ થઈ છે. જેનાથી તે પ્લેટફોર્મના યુઝર્સ દ્વારા પોસ્ટ કરેલ માહિતી માંથી કેશ પ્રિન્ટ અને વોઈસ પ્રિન્ટ જેવી બાયોમેટ્રિક માહિતી ગુમ રીતે એકત્રિત કરી શકે છે.

ટેકકંચ દ્વારા પ્રથમ વખત જોવા મળેલ નીતિ પરિવર્તન 2 જૂનથી અમલમાં આવ્યું છે. યુરોપિયન ઇકોનોમિક એરિયા (ઈઈએ), યુકે, સ્વિટ્ઝર્લેન્ડ અને અન્ય દેશ (ભારત સિવાય) માં યુઝર્સની પોલીસીમાં પરિવર્તન જોવા મળે છે. USAમાં IT એક્ટ મુજબ આ રીતે કોઈ એપ કેશ પ્રિન્ટ અને વોઈસ પ્રિન્ટ જેવી બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરે છે તો જે-તે એપના ડેવલપર્સએ USA ગવર્નમેન્ટને જાણ કરવી જરૂરી છે. પરંતુ ટીક-ટોક એપના ડેવલપર્સએ પોલીસી બદલીને જણાવ્યું કે અમે USAના IT એક્ટ મુજબ જ ફેરફાર કર્યા છે.

વધુમાં કંપની જણાવે છે કે, કંપની ની પ્રાઇવસી પોલીસી અંતર્ગત યુઝર્સની માહિતી જેવી કે વીડીઓમાં બોલતા શબ્દો, પહેરવેશ તથા યુઝર્સના ચહેરાનો ઉપયોગ વિડીઓના વર્ગીકરણ અને તેના જૂથ બનાવવા માટે કરવામાં આવે છે. કંપની જણાવે છે કે બાયોમેટ્રિક ડેટા યુઝર્સના પોસ્ટ થયેલ વિડીઓમાં બોલાયેલ અપશબ્દ અથવા

આપત્તિજનક ટીપ્પણીઓને એકત્રિત કરે છે. જે-તે માહિતી ભવિષ્યમાં ખોટી અથવા આપત્તિજનક સાબિત થાય તો માહિતી ગવર્નમેન્ટને સોંપીને જે-તે યુઝર્સ પર કાયદાકીય પગલા લઈ શકે.

કેલિફોર્નિયા, ઈલિનોઈસ, ન્યુ યોર્ક, ટેક્સાસ અને વોશિંગ્ટન - યુ.એસ. માં ફક્ત કેટલાક ગણતરીના રાજ્યોમાં કંપનીઓને બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકવાના કાયદા છે. જેનો અર્થ એ થાય કે ટીક-ટોક એ યુઝર્સ પાસે અન્ય કોઈ પરમિશન માંગવાની જરૂર નથી. પરંતુ અન્ય રાજ્યો તથા દેશોમાં કંપની યુઝર્સ પાસે બાયોમેટ્રિક ડેટા સંબંધિત પરમિશન માંગે છે અને યુઝર્સએ ફરજિયાતપણે સંમતી આપવી પડે છે.

આ રીતે અપડેટ કરવામાં આવેલ પ્રાઇવસી પોલીસી ઈલિનોઈસના બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન પ્રાઇવસી એક્ટ (BIPA) નું ઉલ્લંઘન કરે છે. જેના કારણે ટીક-ટોક એ કાયદાના ઉલ્લંઘન બદલ 92 મિલિયન ડોલર ચુકવવા પડ્યાં હતા. સમાધાનના ભાગ રૂપે ટીક-ટોક તેની પ્રાઇવસી પોલીસીમાં બાયોમેટ્રિક ડેટા જેવા કે બાયોમેટ્રિક આઈડેન્ટિફાયર્સ, જીઓ-લોકેસન અને જીપીએસ ડેટા એકત્રિત કરવાનું ટાળવા માટે સંમતી દર્શાવી છે. ભવિષ્યમાં આ રીતે પ્રાઇવસી પોલીસીમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા ગવર્નમેન્ટને જાણ કરવી જરૂરી છે.

@beinghumanmj

# DIVINE YOGA

By Geeta

## Children Yoga Class

Every Tuesday 5-6 PM

## Adult Yoga Class

Every Saturday 9-10 AM

## Gratitude Program

Every Thursday 9 PM

**Join today on-ZOOM!**

**: Classes Available :**  
One to One Individual  
and Therapeutic

# Geeta Tailor

## 416-456-2261

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta

## LIFE INSURANCE

MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?  
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$ 500,000		\$ 1,000,000	
	Male	Female	Male	Female	Male	Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- ★ NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)  
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)  
CANCER OR INSURANCE declined by other companies
- ★ CORPORATION OWNED LIF / CRITICAL ILLNESS INSURANCE  
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- ★ MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits

Davinder Singh  
Chawla

416.320.4614

Toll : 1866.623.0865

Call For HONEST ADVICE

MONTHLY & ANNUAL PLANS

## SUPER VISA INSURANCE

HARD TO BEAT OUR PREMIUMS





# તાઉતેના પળતર માટે ગુજરાતે 9,836 કરોડની સહાય માગી

બાગાયતી પાકને ખેતીને જંગી નુકસાન: વીજ, સિંચાઈ, જળ વિતરણ વ્યવસ્થાના આંતરમાળખાને મોટું નુકસાન

અમદાવાદ : ગુજરાત પર 17મી મેએ ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ સર્જેલી તારાજની અસરમાંથી બહાર આવવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ રૂ. 9836 કરોડની સહાયની જરૂરિયાત માટે ગુજરાતની રજૂઆત કરી છે.

વાવાઝોડાને પરિણામે ખેતીવાડી-બાગાયતી પાકો-મકાનો-મસ્યોદ્યોગ, બંદર, પાણીપુરવઠા, વીજળી, માર્ગ રસ્તા અને માળખાકીય સવલતોને થયેલા નુકસાનની વિગતો સાથેનું આવેદનપત્ર મેમોરેન્ડમ ભારત

સરકારને મોકલી આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાત સરકારે તૈયાર કરેલા આવેદનપત્રમાં વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી ગુજરાતમાં થયેલા કુલ નુકસાનને એન.ડી. આર.એફ.ના ધોરણે કેન્દ્ર સરકાર સહાય કરે તેવી આગ્રહપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાની તીવ્રતાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઈલ નેટવર્ક જેવી



માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ૨૨૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને પરિમાને બાગાયતી પાકોના વૃક્ષો

અને ખેતી પાકોના ઝાડ-વૃક્ષ મૂળ સાથે ઉખેડી નાખ્યા છે. ખેતીવાડી-બાગાયતી પાકને થયેલા નુકસાનમાંથી બહાર આવવા કેન્દ્રીય સહાયની જરૂરિયાત

ગુજરાત સરકારને રહેશે.

ગુજરાત પર ત્રાટકેલું વાવાઝોડાએ ૫૦ વર્ષમાં આવેલા કોઈ પણ વાવાઝોડાથી વધુ તીવ્ર અને માલ-મિલકતને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતમાં અગાઉ ૧૯૭૫, ૧૯૮૨ અને ૧૯૯૮ માં જે વાવાઝોડા આવ્યા હતા. ૧૭મી મેએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાએ ૨૩ જિલ્લાઓને અસર પહોંચાડી છે. વિનાશક વાવાઝોડું ૨૮ કલાક સુધી ગુજરાતને ઘમરોળીને ગુજરાતને ચીરીને રાજસ્થાન તરફ ફટાચું હતું.

## ભાજપના પ્રદેશ પ્રભારી સરકાર અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે

અમદાવાદ

લાંબા સમય બાદ ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ શુક્રવારથી ગુજરાતના ૨ દિવસના પ્રવાસે આવવાના છે જ્યાં તેઓ સરકાર અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. જેમાં ભાજપ પ્રભારી કોરોનાની બીજી લહેર બાદની સ્થિતિની સમીક્ષા અને રાજકીય સમીક્ષા પણ કરશે.

સામાન્ય રીતે સંગઠન અને સરકારની કામગીરી અંગે નેતાઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરાશે અને નેતાઓ

પાસેથી કામગીરી અને રાજકીય સ્થિતિ અંગે અભિપ્રાય પણ લેવામાં આવશે. પ્રદેશ પ્રભારીના પ્રવાસ બાદ ૧૫ જૂને ભાજપ વિધાનસભા પક્ષની પણ બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહેશે. તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા માટે જાણ કરાઈ છે. ધારાસભ્યોને નહેલા પ્રશ્નો અને તેમના વિસ્તારમાં સરકારે કરેલી કામગીરી અંગે ચર્ચા થશે. મારુ ગામ

કોરોના મુક્તના સંકલ્પને સાકાર કરવા ધારાસભ્યોને માર્ગદર્શન અપાશે. બેઠકનો રાજકીય હેતુ સરકારની છબી સુધારવાનો અને ધારાસભ્યોને સક્રિય કરવાનો છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોમાં નારાજગી છે જેને ખાળવા હવે ધારાસભ્યોને મેદાનમાં ઉતારવામાં આવશે. સરકારી વ્યવસ્થાની ત્રુટીઓથી જે સમસ્યાઓ ઉભી થઈ હતી અને તેનાથી સરકારની છબી બગડી હોવાનો સ્વીકાર ભાજપના નેતાઓ કરી રહ્યા છે.

## હનીટ્રેપ કેસ : નામ ખૂલતાં PSI બ્રહ્મભટ્ટ ભૂગર્ભમાં ઊતરી ગયા

અમદાવાદ

હનીટ્રેપ કેસમાં રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. અમદાવાદ કાર્થમ બ્રાન્ચે આરોપી પીઆઈ ગીતા પઠાણ સહિતની છ લોકોની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.કે.બ્રહ્મભટ્ટનું પણ નામ ખૂલ્યું છે, જેથી આરોપી પીએસઆઈ ધરપકડથી બચવા ફરાર થઈ ગયા છે. શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફજ બજાવી ચૂકેલાં મહિલા PI ગીતા પઠાણ અને તેમની ગેંગ સોશિયલ મીડિયા થકી

વેપારીઓને ફસાવીને યુવતીઓ હોટેલમાં લઈ જતી હતી.

ત્યાર બાદ કામ પોલીસ ગેંગનું શરૂ થતું હતું. જે આ યુવતીના નામે વેપારીઓને ફેન કરતી હતી અને પોલીસ સ્ટેશનમાં બોલાવી સેટલમેન્ટ કરતી હતી. આ કેસમાં અત્યાર સુધી અનેક લોકો ટાર્ગેટ બની ચક્રા છે. જ્યારે સત્તાવાર રીતે ચાર ફિયાદમાં પોલીસ અને તેની ગેંગ દ્વારા ૨૬ લાખ રૂપિયા લોકો પાસેથી પડાવી લીધા છે. આ રૂપિયામાં ૫૦ ટકા ભાગ રાખવામાં આવતો હતો.

## અમદાવાદ એરપોર્ટમાં વધુ ૧૮ વિમાન પાર્કિંગ સ્ટેન્ડની વ્યવસ્થા કરાશે

અમદાવાદ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વધારાના નવા ૧૮ વિમાન પાર્કિંગ સ્ટેન્ડ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. આ નવી વ્યવસ્થા બાદ અમદાવાદ એરપોર્ટમાં ૧૨ નાના ચાર્ટર્ડ અને ૬ મોટા એરક્રાફ્ટ પાર્ક થશે. અમદાવાદ એરપોર્ટમાં હાલ નાના-મોટા ૩૧ જેટલા વિમાનો પાર્ક થાય છે તેમાં હવે વધારીને નવા ૧૮ પાર્કિંગ સ્ટેન્ડ ઉમેરીને કુલ હવે ૪૯ જેટલા ‘પાર્કિંગ બે ‘ ઉભા કરાશે. અમદાવાદ એરપોર્ટ પર હાલમાં નાના-મોટા ૩૧ જેટલા વિમાનો પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પર ચાર ચાર એમ કુલ આઠ એરોબ્રીજ છે. જેમાંથી મુસાફરો ટમનલમાંથી સીધા ફ્લાઈટમાં અને ફ્લાઈટમાં સીધા ટમનલમાં જઈ શકે છે.

## ગાંધીનગર GPSCમાં નોકરીને નામે 260 વિદ્યાર્થી સાથે ઠગાઈ

ગાંધીનગર

રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે યુવાનો આતુર છે. પણ આ વચ્ચે જ બેરોજગાર યુવાનોને સરકારી નોકરીના સપનાં દેખાડી લૂંટી લેતી ગેંગનો ગાંધીનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોતે IAS ઓફિસર હોવાની વાતો કરી ઠગ ટોળકીએ 260 જેટલાં બેરોજગાર યુવાનોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હોટલ હિલસન અને હોટેલ મિડલ ટાઉનમાં વિદ્યાર્થીઓને નોકરી આપવા બાબતે ચીટિંગ કરી

રહ્યા છે. જે બાદ પોલીસે દરોડા પાડીને હેતવીબેન પટેલ (વાસદા-નવસારી), નીરજકુમાર ગરાસીયા આ બંને લોકો ડેપ્યુટી કલેક્ટર વલસાડના નામે રોકાયા હતા. બાદમાં પોલીસે તેમની સઘન પુછપરછ કરી હતી. જેમાં પર્દાફાશ થયો હતો કે, આ લોકો 130 વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે. અને બંને હોટેલમાં રાખ્યા છે. અને 1 જૂનથી તમામ વિદ્યાર્થીઓને હોટેલમાં રાખ્યા હતા. આ વિદ્યાર્થીઓ પાસેથી સિનિયર ક્લાર્ક, પોલીસ સહિતની ભરતીની લાલચ આપી દરેક વિદ્યાર્થીઓ પાસેથી અલગ-અલગ રકમો લીધી હતી.

## ગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, ૧૭૩ નકલી ડોક્ટર ઝડપાયા

અમદાવાદ

રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં ૧૭૩ નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે ૨ મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭૩ નકલી ડોક્ટરો ઝડપાયા છે. કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા. કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યું હતું. નકલી ડોક્ટરોને પકડવા પોલીસે રાજ્યભરમાં ૨ મહિના સુધી ખાસ ડ્રાઈવ યોજી હતી.

## ફેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડમાં 300 કરોડના ફોડ મુદ્દે સેબીની તપાસ

અમદાવાદ

ફેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના કેટલાક સિનિયર અધિકારીઓ સામે માર્કેટનું નિયમન કરતા સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ-સેબી દ્વારા છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવે તેવી સંભાવના છે. ફેન્કલિન ટેમ્પલ્ટનની કફોડી સ્થિતિમાં મૂકાયેલી છ ડેટ સ્કીમને લગતી ખાનગી અને જાહેર જનતાથી છૂપી રાખવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને તેમણે તેમના પોતાના અંગત રોકાણો પાછા ખેંચી લીધા હતા. આ અધિકારીઓને પ્રીવેન્શન ઓફ ફોડયુલન્ટ એન્ડ અનફેર ટ્રેડિંગ પ્રેક્ટિસના ધારાધોરણોનો ભંગ કરવા બદલ

ગુનેગાર ઠેરવવામાં આવે તેવી સંભાવના છે. તેમણે ઈન્સાઈડ ઈન્ફોર્મેશનનો ગેરલાભ ઊઠાવીને પોતાના રૂ. 304 કરોડનો ઉપાડ કરી લીધો છે. બીજા રોકાણકારોના પૈસા ડૂબવા દીધા છે. અધિકારીઓને

ફેન્કલિન ટેમ્પલ્ટનના છ ડેટ ફંડ અંગેની કોન્ફિડેન્શિયલ માહિતી અગાઉથી જ મળી ગઈ હતી. સ્કીમમાં કેટલું બોરોઈંગ કરવામાં આવ્યું છે તથા રેગ્યુલેટરી ઓથોરિટી સમક્ષ કઈ કઈ અને કેવી વિગતો ફાઈલ કરવામાં આવી છે તેની માહિતી તેમને મળી ગઈ હતી. તેમ જ જાહેર જનતાને અન્ય માહિતીની જાણકારી અપાય તે અગાઉ જ તેમને આ તમામ માહિતી મળી ગઈ હતી. હવે આ કેસની તપાસ સેબીને સોંપાઈ છે.

## ધોલેરા ખાતે 11 હજાર કરોડના ચાઈના ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું ભાવિ અધ્યરતાલ

ગાંધીનગર : રવિવાર ગુજરાતના ધોલેરા સ્પેશલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન (સર) માં ચાઈના ઈન્ડસ્ટ્રીયલ પાર્કના 10,500 કરોડના પ્રોજેક્ટનું બાળમરણ થાય તેવી સંભાવના છે, કારણ કે ભારત અને ચીન વચ્ચેના વણસેલા સંબંધોના કારણે આ પ્રોજેક્ટનું ભાવિ ધૂંધળું બન્યું છે. આ પ્રોજેક્ટ ચાલુ રાખવો કે રદ કરવો તે અંગે રાજ્ય સરકારે હજી સુધી કોઈ સ્પષ્ટતા પણ કરી નથી. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે સરકારે ધોલેરામાં ચાઈના ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ચાઈના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝિસ સાથે બે પ્રકારના સમજૂતિ કરાર કર્યા હતા. પ્રોજેક્ટ ઉભો થતાં ગુજરાતમાં સ્થાનિક

કક્ષાએ ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ કક્ષાએ 15000 લોકોને રોજગારી મળવાની આશા છે. આ કરાર પ્રમાણે ચાઈનાના મૂડીરોકાણથી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક શરૂ કરવામાં આવનાર છે, જો કે બન્ને દેશો વચ્ચે સરહદના તનાવથી સંબંધોમાં ખટરાગ ઉભો થયેલો છે તેથી આ પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઈ ટેકનોલોજીયુક્ત ઊદ્યોગો ચાલનાના ઊદ્યોગકારો એકમો શરૂ કરવાના હતા. કરાર ઉપર મુખ્યમંત્રીના અગ્રસચિવ અને ઊદ્યોગ અગ્રસચિવ એમકે દાસ તેમજ CASME ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ગ્રુપના વાર્ધસ પ્રેસિડેન્ટ વૈન્ડોંગ યીને હસ્તાક્ષર કર્યા હતા.

ભારત અને ચીન વચ્ચે સરહદે તણાવ ઊભો થતા પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે





## છત્તીસગઢમાં પતિ સાથે ઝઘડો થયા બાદ મહિલાએ 5 પુત્રી સાથે ટ્રેન નીચે અંપલાવ્યું

છત્તીસગઢ

છત્તીસગઢમાં સામૂહિક આત્મહત્યાનો કાળજી કંપાવી દે તેવો મામલો સામે આવ્યો છે. પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ પોતાની પાંચ પુત્રીઓ સાથે ટ્રેન સામે પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી છે. છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં એક મહિલા અને તેની પાંચ પુત્રીઓના મૃતદેહ રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે સૌથી મોટી પુત્રીની વય ૧૭ વર્ષ અને સૌથી નાની પુત્રીની વય ૧૦ વર્ષ હતી. આત્મહત્યા કરનાર મહિલાનું નામ ઉમા સાહુ હોવાનું અને તેની વય ૪૫ વર્ષ હોવાનું બહાર આવ્યું છે. તેની પાંચ પુત્રીઓના નામ અન્નપૂર્ણા, યશોદા, ભૂમિકા, તુલસી અને કુમકુમ છે.

પોલીસને વહેલી સવારે ઘટનાની જાણકારી મળી હતી. પોલીસના કહેવા પ્રમાણે રાતે મહિલાનો પતિ સાથે ઝઘડો



થયો હતો અને એ પછી પોતાની પુત્રીઓ સાથે નીકળી ગઈ હતી. તમામના મૃતદેહ રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. જોકે આ ઘટનામાં તપાસ ચાલી રહી છે પણ મહિલાએ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

## બિહારે છુપાવેલાં આંકડા જાહેર થતાં દેશમાં કોરોનાથી વધુ ૬૧૪૮ના મોત

નવી દિલ્હી

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમિત ૬૧૪૮ દર્દીનાં મોત નોંધાયાં હતાં. દેશમાં કોરોના મહામારીનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો દૈનિક મોતનો આંકડો છે. બિહારે અત્યાર સુધી છુપાવેલા ૩૯૫૧ મોતનો આંકડો જાહેર કરતાં દૈનિક મોતનો આંકડો આટલો મોટો નોંધાયો છે. જો બિહારનો આંકડો બાદ કરીએ તો દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૯૭ દર્દીનાં મોત થયાં હતાં.

મહારાષ્ટ્રએ છેલ્લા ૧૨ દિવસમાં કોરોનાના કારણે થયેલા મોતના

આંકડામાં ૫૦૦૦ કરતાં વધુનો ઉમેરો કર્યો છે. ૧૭થી ૨૮ મે વચ્ચે મહારાષ્ટ્રે ૧૧,૭૧૨ મોત ઉમેર્યાં હતાં. તેમાંથી ૬૬૨૨ મોત ડેઈલી અપડેટમાં નોંધાયાં હતાં જ્યારે ૫૦૮૦ મોત અપડેટ પ્રક્રિયા દરમિયાન ઉમેરવામાં આવ્યાં હતાં. દેશમાં કોરોના સંક્રમણના દૈનિક કેસ સતત ત્રીજા દિવસે એક લાખથી નીચે ૮૪,૦૫૨ નોંધાયાં હતાં. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૯,૧૮૩,૧૨૧ ઉપર પહોંચી હતી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૧,૩૬૭ દર્દી રિકવર થતાં રિકવરી રેટ વધીને ૮૪.૭૬ ટકા પર પહોંચ્યો હતો.

## યસ બેંકના કરોડો ટ્રાન્સફર થવા મામલે CBIના ૧૪ સ્થળ પર દરોડા

નવી દિલ્હી

વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન યસ બેંકમાં ૪૬૬ કરોડ રૂપિયાનું ફંડ ટ્રાન્સફર કરવાના કેસમાં સીબીઆઈએ દિલ્હી-એનસીઆર અને અન્ય ત્રણ શહેરોમાં કુલ ૧૪ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. સીબીઆઈએ ઓયસ્ટર બિલ્ડવેલ પ્રાઈવેટ લિમિટેડ, અવન્યા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપર અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યા પછી આ દરોડા પાડ્યા હતાં.

સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર યસ બેંકમાં ફંડ ટ્રાન્સફરના અન્ય એક કેસમાં થાપરની અગાઉથી જ તપાસ ચાલી રહી છે.

આ કેસમાં બેંકના પૂર્વ વડા રાણા કપૂર પણ સંડોવાયેલા છે. વર્તમાન કેસમાં સીબીઆઈએ ઓયસ્ટર બિલ્ડવેલ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટરો રઘુભીરકુમાર શર્મા, રાજેન્દ્રકુમાર મંગલ અને તાપસી મહાજન તથા અવન્યા રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ અને ઝાબુઆ પ્રાઈવેટ લિમિટેડના અજાણ્યા એક્ઝિક્યુટીવ સામે પણ કેસ દાખલ કર્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર ઓયસ્ટર બિલ્ડવેલ પ્રાઈવેટ લિમિટેડ અવન્યા ગ્રુપની પેટા કંપની છે. ઓયસ્ટર બિલ્ડવેલ પ્રાઈવેટ લિમિટેડનો ૯૭ ટકા હિસ્સો અવન્યા રિયલ્ટી પાસે છે.

## ભાજપના નેતાની દીકરી સાથે હેવાનિયત, રેપ બાદ આંખો કાઢી લાશ ઝાડ પર લટકાવી ઝારખંડમાં પોલીસે પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી

નવી દિલ્હી

ઝારખંડ ખાતેથી એક કાળજી કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પલામૂ જિલ્લા ખાતે કેટલાક દુષ્ટોએ હેવાનિયતની તમામ હદો પાર કરતા ભાજપના સ્થાનિક નેતાની 16 વર્ષીય દીકરીની નિર્મમ હત્યા કરી દીધી છે. સૌ પ્રથમ સગીરા સાથે બળાટકાર થયો હતો અને બાદમાં તેની આંખો કાઢી લેવામાં આવી હતી. આખરે આત્મહત્યા તરીકે રજૂ કરવા માટે તેના મૃતદેહને ઝાડ સાથે લટકાવી દેવામાં

આવ્યો હતો. આ કેસમાં પોલીસે પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના ગત 7 જૂનના રોજ બની હોવાનું કહેવામાં આવે છે. તે દિવસે સવારે 10:00 કલાકે પીડિતા ઘરની બહાર ગઈ હતી અને પાછી ન ફરતા પરિવારજનોએ સોમવારે પોતાની રીતે શોધખોળ આરંભી હતી. ત્યાર બાદ પાંકી થાણામાં મિસિંગ રિપોર્ટ લખાવવામાં આવ્યો હતો અને પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.

પોલીસ પીડિતાને શોધવા પ્રયત્ન કરી રહી હતી તે સમયે બુધવારે તેમને લાલીમાટી જંગલમાં તેનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળી આવ્યો હતો. મૃતકના પિતાએ જણાવ્યું કે, તેમને 4 દીકરી અને એક દીકરો છે તથા હત્યાએ તેમની મોટી દીકરીનો ભોગ લીધો છે.

કેસની તપાસ કરી રહેલી પોલીસને ઘટના સ્થળેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો જેના આધારે પ્રદીપની ધરપકડ થઈ શકી હતી.

## દક્ષિણ બંગાળમાં વીજળી પડવાને કારણે ૨૦થી વધુ લોકોનાં મોત, ૩ ઈજાગ્રસ્ત

મૃતકોના પરિવારજનોને બે લાખ, ઘાયલોને 50,000 આપવાની જાહેરાત કરી

કોલકાતા

દક્ષિણ બંગાળમાં વીજળી પડવાને કારણે ઓછામાં ઓછા ૨૦ લોકોનાં મોત થયા છે તેમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વીજળી પડવાને કારણે મુર્શિદાબાદમાં ૮ અને હુગલીમાં ૮ લોકોનાં મોત થયા છે. જ્યારે પૂરબા મેદિનિપુર જિલ્લામાં વીજળી પડવાને કારણે બે લોકોનાં મોત થયા છે.

મુર્શિદાબાદ જિલ્લામાં વીજળી



પડવાને કારણે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે જાંગીપુર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે કોલકાતા સહિતના દક્ષિણ બંગાળમાં

આજે બપોરથી ધોધમાર વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાને કારણે મૃત્યુ પામેલા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમણે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા આ પ્રિમોન્સુન વરસાદ હતો. ભયજનક ઈમારતોમાં રહેતા લોકોને જરૂર પડે તો સલામત સ્થળે ખસેડવાના નિર્દેશ આપ્યા છે.

## બિહારમાં ચાર મિનિટમાં HDFC બેંકમાં રૂપિયા 1.19 કરોડની લૂંટ

પાવર બેંક અને ઈએસ પ્લાન નામની એપની લોકો છેતર્યા

પટના

બિહારના વૈશાલીમાં એક મોટી ઘટના બની છે. ગુરુવારે સવારે હાજીપુરના જહુઆમાં એચડીએફસી બેંકની શાખામાંથી એક કરોડ 19 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. બાઈક ઉપર આવેલા આઠથી દસ ગુનેગારોએ ચાર મિનિટમાં જ સમગ્ર ખેલ પાડી દીધો. લૂંટ બાદ બદમાશો હથિયારો લહેરાવતાં કોથળામાં પૈસા ભરીને નાસી છુટ્યા હતા. ખાતમી મળતાં હાજીપુર સદર રાઘવ દયાલ સહિતના એસ.ડી.પી.ઓ. સહિત અનેક

વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. ઘટના બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. એવું કહેવામાં આવે છે કે ગુરુવારે સવારે આઠથી દસ માસ્ક પહેરાલા ગુનેગારો હાજીપુરના જહુઆમાં એચડીએફસી બેંકની શાખા પહોંચ્યા. જ્યારે આરોપીઓ બેંકમાં પ્રવેશ્યા ત્યારે સુરક્ષાગાર્ડ તેમના હાથ સેનિટાઈઝ કરાવ્યા.

## પુરી જગન્નાથની રથયાત્રા યોજાશે, પણ શ્રદ્ધાળુઓ તેમાં જોડાઈ શકશે નહીં

નવી દિલ્હી

ઓડિસાનાં પુરીમાં 12 જુલાઈએ યોજનારી ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા અંગે રાજ્ય સરકારે આજે મહત્વની ઘોષણા કરી કે રથયાત્રા ચોક્કસ નિકળશે પણ શ્રદ્ધાળુઓને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં નહીં આવે. તેમાં પણ કોરોના ગાઈડલાઈન્સનું કડક પાલન કરવાનું રહેશે. વિશેષ રાહત કમિશનર પી કે જેનાએ જણાવ્યું કે આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા પુરીમાં ભક્તો વિના યોજાશે. વહીવટીતંત્રે રાજ્યના અન્ય ભાગોમાં સમારોહ અને કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. એસઆરસીએ જણાવ્યું કે માત્ર પસંદ કરેલા સેવકોને રસીના બંને ડોઝ લીધા છે તેમને કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

## પુણેમાં સેનિટાઇઝરની કંપનીમાં આગ, મહિલા સહિત 18 ભૂંજાયા

મુંબઈ

પુણેમાં કેમિકલ કંપનીમાં આજે ભીષણ આગ લાગતા 18 જણ મોતને ભેટ્યા હતા. મૃતકમાં 15 મહિલાનો સમાવેશ હોવાનું કહેવાય છે. અહીં સેનિટાઇઝર બનાવવામાં આવતું હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હોવાની ચર્ચા થઈ રહી છે. ફાયરબ્રિગેડે કલાકોની જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવને લીધે શોકની ઘાયા ફરી વળી હતી. કંપનીમાં સુરક્ષાની યોગ્ય કાળજી રાખવામાં આવી નહોતી એવો આરોપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે કંપનીના માલિકને



તાબામાં લઈ વધુ તપાસ આદરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ પ્રાથમિક તપાસમાં જાણી શકાયું નહોતું. કોરોનાને લીધે મહારાષ્ટ્ર સહિત સંપૂર્ણ દેશમાં ચિંતાનુ વાતાવરણ છે કોરોનાથી બચાવ સેનિટાઇઝરનો ઉપયોગ કરાય છે.

## ડીઝલ કૌભાંડ: ફોકસવેગનના ભૂતપૂર્વ સીઈઓ 1.3 કરોડ ડોલર કંપનીને ચૂકવશે

નવી દિલ્હી

નવી દિલ્હી : ફોકસવેગને બુધવારે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સીઈઓ માર્ટિન વિન્ટરકોર્ન ડીઝલ એન્જિન કૌભાંડમાં તેમની ભૂમિકા બદલ ૧.૧૨ કરોડ યુરો (૧.૩૬ કરોડ ડોલર) ચૂકવવા સંમત થયા છે. કંપનીએ તેના ડીઝલ એન્જિનોમાં પ્રદૂષણ વિરોધી નિયમોને ચાતરીને તેના એન્જિનોની ક્ષમતા ઊંચા સ્તરની દર્શાવવાનું કૌભાંડ કર્યું હતું. ડીઝલ વાહનોમાં આ પ્રકારના કૌભાંડ બદલ પ્રતિષ્ઠિત કંપનીની ભારે બદનામી થઈ હતી. જર્મન ઓટો કંપનીએ જણાવ્યું હતું કે તેને ડિરેક્ટરો અને ઓફિસરોના પગલાના લીધે થયેલી ખોટમાં જવાબદારીના વીમા પેટે ૨૭ કરોડ યુરો ની રકમ મળવાની છે.



# મુંબઈના મલાડમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં ૧૧નાં મોત, સાત ઘાયલ

મુંબઈ

મુંબઈમાં બુધવારે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ આખો દિવસ પડેલા વરસાદનો કારણે મલાડ વેસ્ટના માલવાની વિસ્તારમાં અબ્દુલ હમીદ રોડ પરના ન્યૂકલેક્ટર કમ્પાઉન્ડમાં રાતના ૧૧.૧૦ કલાકે ચાર માળની એક ઈમારત ધરાશાયી થતાં તેનો કાટમાળ બાજુના મકાન પર પડ્યો હતો. આ કાટમાળમાં ૧૮ લોકો દટાઈ જતાં ૧૧નાં કુરુણ મોત થયાં હતાં જ્યારે અન્ય ૭ને બહાર કાઢી બીડીબીએ નગર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં. ભોગ બનેલા બાજુના મકાનમાં ૩ પરિવાર રહેતાં હતાં. મૃતકોમાં ૮ બાળકનો સમાવેશ છે. જોઈન્ટ સીપી વિશ્વાસ નાગરે પાટિલે જણાવ્યું હતું કે, મુંબઈ પોલીસે મકાનના માલિક રિઝવાન રફી સિદ્દિકી સામે સદોષ માનવવધનો કેસ દાખલ કર્યો છે.



સીએમ ઉદ્ધવ ઠાકરેએ કોંઈવલી હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તો અંગે જાતમાહિતી મેળવી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની સહાય જાહેર કરી હતી. મલાડની દુર્ઘટનામાં રિઝવાન રફી સિદ્દિકી નામની વ્યક્તિના ૮ પરિવારજનોનાં મોત થયાં છે. સિદ્દિકીએ જણાવ્યું હતું કે, રાતના લગભગ ૧૦ કલાકે હું દૂધ લેવા બહાર ગયો હતો.

# મેહુલ ચોકસીને પ્રતિબંધિત વિદેશી નાગરિક બહાર કરી દેતું ડોમિનિકા

નવી દિલ્લી

કુલેકાબાજ મેહુલ ચોકસીને ડોમિનિકાએ પ્રતિબંધિત વિદેશી નાગરિક જાહેર કરી દીધો છે. ડોમિનિકા સરકારના દસ્તાવેજોના દાવા પ્રમાણે ચોકસીના એ દાવાનો છેદ ઊડી ગયો છે કે તેણે ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો નથી. તે પ્રતિબંધિત વિદેશી નથી તેથી પોલીસ તેની ધરપકડ કરી શકે નહીં. ડોમિનિકાના ગૃહમંત્રાલયે જારી કરેલી નોટિસ અનુસાર મેહુલ ચોકસીને ૨૫મી મેના રોજ પ્રતિબંધિત વિદેશી નાગરિક જાહેર કરાયો હતો. મંત્રાલયે દેશના ઈમિગ્રેશન એન્ડ પાસપોર્ટ એક્ટમાં સ્થાપિત પ્રક્રિયા

પ્રમાણે મેહુલ ચોકસીને રિપબ્લિક ઓફ ડોમિનિકામાંથી દેશનિકાલ કરવાની સૂચના પણ આપી દીધી હતી. મંત્રાલયે ૨૫મી મેના દિવસે જ ચોકસીને અલગ નોટિસ પાઠવીને જણાવ્યું હતું કે, તેને ડોમિનિકામાં પ્રવેશ કરવાની પરવાનગી નથી. તેને દેશનિકાલ કરવા માટે જરૂરી તમામ પગલાં લેવા પોલીસને સૂચના આપી દેવાઈ છે.

હવે ડોમિનિકા અને એન્ટિગુઆ એમ બંને દેશે ચોકસીને સંઘરવાનો ઈનકાર કરી દીધો છે. ડોમિનિકામાં ધરપકડ કરાયા પછી દેશની સરકારે ચોકસીના ડોમિનિકામાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરી દીધો હતો.

# મદ્રેસામાં રહસ્યમય વિસ્ફોટ, મૌલાનાનુ મોત, NIAને તપાસ સોંપાઈ

પટના

બિહારના બાંકા જિલ્લાની એક મદ્રેસામાં થયેલા બ્લાસ્ટના મામલાની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ કરશે. એજન્સીએ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને ટેક ઓવર કરી લીધી છે અને આ મામલામાં કોઈ સ્લીપર સેલનો હાથ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટ દરમિયાન મદ્રેસામાં ૩૩ વર્ષના એક મૌલાના અબ્દુલ મોબિનનુ મોત થયું હતું. તે ઝારખંડનો રહેવાસી હતી. એજન્સીએ હવે પોતાની તપાસ ઝારખંડ સુધી લંબાવી છે. સૂત્રોના કહેવા પ્રમાણે અહીંયા ફોરેન્સિક તપાસ કરનાર ટીમને વિસ્ફોટકોના અંશ પણ મળ્યા છે. જેના કારણે હવે તપાસની જવાબદારી એનઆઈએને સોંપી દેવાઈ છે.

# ભાજપને વર્ષમાં 750 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને 139 કરોડ મળ્યા

લખનઉ

ભાજપ અને કોંગ્રેસ દેશની સૌથી બે રાજકીય પાર્ટીઓ છે. બંને પાર્ટીઓને જોકે લોકસભાની ગત ચૂંટણીમાં મળેલી બેઠકોમાં ઘણું અંતર છે અને તેવું જ પાર્ટીઓને મળી રહેલા દાનની રકમમાં પણ છે. છેલ્લા સાત વર્ષથી ભાજપ ડોનેશન મેળવવામાં કોંગ્રેસથી આગળ છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2019-20માં પાર્ટીને 750 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. જે કોંગ્રેસ પાર્ટીને મળેલા 139 કરોડ રૂપિયાના ફંડ કરતા પાંચ ગણુ વધારે છે.

આ એક વર્ષના સમયગાળામાં એનસીપીને 59 કરોડ, ટીએમસીને 8 કરોડ, સીપીએમને 19.6 કરોડ રૂપિયા અને સીપીઆઈને 1.9 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ભાજપને સૌથી વધુ દાન આપનારાઓમાં ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરની જ્યુપિટર કેપિટલ, આઈટીસી ગ્રૂપ, મેકોટેક ડેવલપર્સ, પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ, બીજી શિકે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ સામેલ છે. નાણાકીય વર્ષ 2019-20માં એકલા પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ ફંડ દ્વારા ભાજપને 217 કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે.

# વૈષ્ણોદેવી મંદિર સંકુલમાં લાગી ભયાનક આગ, શોર્ટ સર્કિટની આશંકા

જમ્મુ

જમ્મુ-કાશ્મીરનાં કટરામાં સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિર સંકુલમાં ભીષણ આગ લાગી હતી. મંદિર પરિસરમાં આવેલા કાલિકા ભવન પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ ફાટી નીકળી હતી. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. રિપોર્ટ મુજબ જ્યાંથી આગ લાગી ત્યાંથી કુદરતી ગુફાનું અંતર લગભગ એકસો મીટર છે. ભૈરો ઘાટી સુધી અગ્નિની જ્વાળાઓ દેખાય છે. વીઆઈપી ફાટક પાસેના કાઉન્ટિંગ હોલમાં શોર્ટ સર્કિટને કારણે આગ શરૂ થઈ હોવાનું કહેવાય છે. ટૂંક સમયમાં આગએ એક ભયંકર રૂપ ધારણ કર્યું.

## MOTEL for SALE

### NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.com

Website: <https://niraj-pancholi.c21.ca/>

Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience  
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...  
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...

Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011  
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings

MOTEL KING : Specializing in Selling Motels: LIST & SELL with confidence

<p style="color: red; font-weight: bold;">18 Room Motel Near Pembroke - \$925,000</p> <p>1.5 hrs from Ottawa / 4 hrs from GTA</p>	<p style="color: red; font-weight: bold;">14 Room Motel Near Ottawa - \$999,000</p> <p>Within the city, 4 rooms with full kitchenette Low operating costs. All amenities near by</p>
<p style="color: red; font-weight: bold;">42 Room Motel Near Timmins - \$1,300,000</p> <p>On Hwy 11, Within the city, indoor corridor</p>	<p style="color: red; font-weight: bold;">27 Room Motel in Thunder Bay - \$1,999,000</p> <p style="color: red; font-weight: bold;">60 Room Motel in Thunder Bay - \$2,000,000</p>
<p style="color: red; font-weight: bold;">Small to Mid-Size Motels in Northern Ontario</p> <p>Price: \$1,300,000 to \$2,000,000</p>	<p style="color: red; font-weight: bold;">30+ Room Motel Near Sudbury - \$2,000,000</p> <p>VTB available, 40% down payment require from buyer</p>
<p style="color: red; font-weight: bold;">Other 15 to 40 Room motels coming up for sale</p> <p>Price: \$1M to \$3.5M - Buyers with 40% down, get ready</p>	<p style="color: red; font-weight: bold;">Recently SOLD Motels Near</p> <p>Welland, London, Sarnia, North Nay, Cochrane, Sudbury</p>

Motel Job or Working Partner opportunity

@ Experienced Motel Operator: to run motel in northern Ontario, English & computer knowledge require. Good salary.

@ Working Partner: willing to invest minimum \$200K, offering 25% to 50% partnership + management salary to run the motel in north

SERIOUS BUYERS: you must need about 35% down payment & to sign buyer representation agreement.  
Call for personal meeting to see motel's financial & to discuss mortgage options. Private finance available.

Century 21 People's Choice Realty Inc., 120 Matheson Blvd E, Unit 103, Mississauga, L4Z 1X1 Office Ph.: 905-366-8100



## મીટ ઉત્પાદક કંપની જેબીએસ પર સાઈબર એટેક : કંપનીએ એક કરોડ ડોલર ચૂકવ્યાં

સાઈબર એટેકના કારણે ઓસ્ટ્રેલિયા-કેનેડાના યુનિટ બંધ પડ્યા હતા

કેનવર

દુનિયાની સૌથી મોટી મીટ ઉત્પાદક કંપની જેબીએસ પર મોટો સાઈબર હુમલો થયો હતો. કંપનીએ આખી સિસ્ટમને અનલોક કરવા માટે એક કરોડ ડોલરની રકમ ચૂકવી હતી. આ સાઈબર એટેક પાછળ રશિયન હેકર્સનો હાથ હોવાની શક્યતા એફબીઆઈએ વ્યક્ત કરી હતી.

બ્રાઝિલની મીટ ઉત્પાદક કંપની જેબીએસ અમેરિકા-ઓસ્ટ્રેલિયા-કેનેડા જેવા દેશોમાં વ્યાપક બિઝનેસ ધરાવે છે. આ કંપની ઉપર ગત ૩૧મી મેના

રોજ મોટો સાઈબર એટેક થયો હતો. હેકર્સે કંપનીના સર્વરને હેક કરી લીધા હતા. કંપનીએ એફબીઆઈની મદદ માગી હતી. અમેરિકન એજન્સી એફબીઆઈએ તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન હેકર્સે કંપનીની સિસ્ટમ ફરીથી ચાલુ કરવા માટે ૧.૧ કરોડ ડોલર એટલે કે અંદાજે ૮૦ કરોડ રૂપિયાની માગણી કરી હતી. રેન્સમવેર એટેકના કારણે કંપનીની ડિજિટલ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. કેનેડા અને ઓસ્ટ્રેલિયાના યુનિટ તો બંધ કરવા પડ્યા હતા. આખરે કંપનીએ

૧.૧ કરોડ ડોલરની રકમ આપવાની તૈયારી બતાવી હતી. આ અંગે કંપનીના સીઈઓ આન્દ્રે નોગ્યુરાએ કહ્યું હતું કે હેકર્સને ખંડણી આપવાનો નિર્ણય ખૂબ જ કપરો હતો, પરંતુ કંપનીએ ન છૂટકે એ નિર્ણય લીધો હતો. ગ્રાહકોની સુરક્ષા માટે કંપનીએ આખરે ખંડણી આપી દેવાનું નક્કી કર્યું હતું. કંપનીએ બિટ કોઈન્સમાં આ રકમ ચૂકવી હતી. મીટ ઉત્પાદક કંપનીએ કહ્યું હતું કે દર વર્ષે કંપની આઈટી અને આઈટી એક્સપર્ટની સેવા પાછળ ૨૦ કરોડ ડોલરનો ખર્ચ કરે છે.

## ગાંધીજીના પ્રપૌત્રીને આફ્રિકામાં ઠગારના કેસમાં સાત વર્ષની જેલ

કારોબારી દ્વારા 62 લાખ રેન્ડ હડપવાનો આરોપ મૂકાયો

જોહાન્સબર્ગ

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને દક્ષિણ આફ્રિકાની ડર્બનની અદાલતે સાત વર્ષની સજા ફટકારી છે. તેમના પર ભારતમાંથી એક ખેપ લાવવા માટે આયાત અને કસ્ટમ્સ ડ્યુટીને મેનેજ કરવાના નામે એસઆર મહારાજ નામના કારોબારી પાસેથી 62 લાખ રેન્ડ હડપવાનો આરોપ હતો.

ડર્બનની વિશેષ આર્થિક અપરાધ અદાલતે તેમને તેમની સામે દાખલ કરાયેલા તહોમતનામા અને સજા બંને સામે અપીલ કરવાની મનાઈ ફરમાવી દીધી છે. લતા સામે 2015માં કેસની એનપીએના ડિરેક્ટર હંગવાની



મુલોદજીએ જણાવ્યું હતું કે તેમણે સંભવિત રોકાણકારોને ભારતથી લીનનના ત્રણ કન્ટેનર આવી રહ્યા છે તે સમજાવવા માટે નકલી રસીદ અને દસ્તાવેજ આપ્યા હતા. તે સમયે લતાને 50,000ના રેન્ડની જમાનત પર છોડવામાં આવી હતી.

## ટેકનોલોજી અને ઉત્પાદનમાં ચીનને પછાડવા USA સંસદમાં બિલ પસાર

વોશિંગ્ટન

અમેરિકન સંસદે ચીન સાથેની આર્થિક હરીફાઈમાં સુધારો કરવા માટે અને ત્યાંની કોમ્યુનિસ્ટ સરકારની ચાલબાજીઓ માટે જવાબદાર ઠેરવવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું છે. સંસદે આ મહત્વપૂર્ણ ચીન વિરોધી બિલને ૬૮-૩૨ મતોથી પસાર કર્યું હતું. આ બિલ પસાર થવાને સંસદના બહુમતી દળના નેતા ચાક શુમારનો એક મોટો રાજકીય વિજય ગણવામાં આવી રહ્યો છે. યુએસ ઈનોવેશન એન્ડ કોમ્પિટિશન એક્ટ હેઠળ મહત્વપૂર્ણ

વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનમાં અમેરિકાની સ્થિતિ મજબૂત કરવા માટે ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે. આ બિલને કારણે જરૂરી સપ્લાય ચેનની સુરક્ષા અને કટોકટી દરમિયાન સપ્લાય ચેનમાં ઉદભવતા અવરોધોને દૂર કરવા માટે અમેરિકાની શક્તિ વધશે. આ ઉપરાંત આ બિલને કારણે નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ માટે ફંડિંગ વધશે. જો કે આ બિલ હજુ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પસાર થવાનું બાકી છે. ત્યાં પસાર થયા પછી જ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે.

## ચીનની રસી: WHOની મંજૂરી હોવા છતાં સાઉદી અરેબિયા સહિતનાં દેશોનો વિરોધ

બેઈજિંગ

ચીનમાં બનેલી કોરોનાવાયરસ વિરોધી રસી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની મંજૂરી મેળ્યા પછી પણ, ઘણા દેશો તેને મંજૂરી આપી રહ્યા નથી. આ દેશોમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને બહેરેન સહિત મધ્ય-પૂર્વ એશિયાના ઘણા દેશોનો સમાવેશ થાય છે. યુએઈએ એમ પણ કહ્યું છે કે જે લોકોએ ચીનની રસી લીધી હોય, તેમને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

અને ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનની કોરોના રસી ઉપર ઘણા સવાલો ઉભા થયા છે. સેશેલ્સમાં મે મહિનામાં અચાનક કોરોનાનાં કેસો વધી ગયા હતા. અહીં વિશ્વનું સૌથી ઝડપી રસીકરણ કરવામાં આવ્યું હતું, અને મોટાભાગના લોકોને ચીનમાં બનેલી સિનોફોર્મ રસીનો ડોઝ અપાયો હતો. રસીકરણ પછીના કેસોમાં અચાનક થયેલા વધારાએ પણ રસીની અસરકારકતા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા.

ત્યારબાદથી સાઉદી અરેબિયા, બહેરેન, ફિલિપાઈન્સ અને યુએઈ જેવા દેશોએ ચીનની રસીની અસરકારકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

મેના અંતમાં સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલિપિન્સનાં લોકો ચીનની રસી એટલા માટે નથી ઈચ્છતા કારણ કે તેમને તેની સલામતી અને અસરકારકતા અંગે શંકા છે.

## અમેરિકાની સેનેટમાં રજૂ થયું નવું બિલ, અનેક ભારતીય ડોક્ટરોને મળશે લાભ

વોશિંગ્ટન

અમેરિકામાં ડોક્ટરોની અછતને દૂર કરવા માટે વિદેશી નાગરિકોને આકર્ષિત કરવાની યોજના પર કામ શરૂ થઈ ચૂક્યું છે. આ માટે પ્રભાવશાળી સાંસદોના દ્વિદલીય જૂથે એક એવો ખરડો બીજી વાર રજૂ કરવાની ઘોષણા કરી છે કે જે દેશના ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે પરદેશી ડોક્ટરોને આકર્ષિત કરશે.

દેશના સંસદીય ગૃહ સેનેટની સ્વાસ્થ્ય, શિક્ષણ, શ્રમ અને પેન્શન સમિતિના સભ્ય સેનેટર જૈકી રોજેન



સહિતના અનેક સાંસદોએ આ ખરડાને બીજી વાર રજૂ કર્યો છે. આ જ પ્રકારનો ખરડો સાંસદ બ્રૅડ સ્નાઈડરે પ્રતિનધિ સભામાં રજૂ કર્યો. જો આ ખરડો અમેરિકાના બંને ગૃહોમાં પસાર થઈને એના પર રાષ્ટ્રપતિના

હસ્તાક્ષર થઈ જાય તો એ હજારો ભારતીય ડોક્ટરોને સૌથી વધુ લાભ થશે, જેઓ ત્યાં વસ્યા છે. તદુપરાંત, નોકરી-વ્યવસાય માટે અમેરિકા જવા માગતા ડોક્ટરોને પણ આ સૂચિત કાયદાનો પ્રત્યક્ષ લાભ મળશે. કોનરાડ સ્ટેટ 30 એન્ડ ફિઝિશિયન એક્સિસ રિઓથોરાઈઝેશન એક્ટને ફરીથી રજૂ કરવાથી જેમની રેસિડેન્સી પ્રશિક્ષણ કાર્યક્રમની મર્યાદા પૂરી થઈ ચૂકી છે એવા વિદેશી ડોક્ટરો, ડોક્ટરોની અછતવાળા વિસ્તારોમાં સેવા પૂરી પાડી શકશે.

## પાકિસ્તાનમાં ખતરનાક ટ્રેન અકસ્માત: 50નાં મોત, 70 કરતાં વધુ લોકો ઘાયલ



પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાનક ટક્કર થતાં ૫૦ મુસાફરોનાં મોત થયા હતા. ૭૦ કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. અસંખ્ય મુસાફરોને હજુય ઊંઘા વળી ગયેલા ડબ્બામાંથી મહામુસાબતે સૈન્યની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

## સ્લોવેનિયામાં મહિલાઓને મળી જીત, સંમતિ વગરના સેક્સને બળાત્કાર ગણાશે

લુબ્લિયા

હવે, યુરોપીય દેશ સ્લોવેનિયામાં પણ સ્ત્રીની સંમતિ વિના એની સાથે કરાતા સેક્સને બળાત્કાર ગણવામાં આવશે. દેશની સંસદે એના ક્રિમિનલ કોડમાં આ સંબંધે સુધારો કર્યો છે. સ્લોવેનિયાએ ઈ.સ.2015માં જેને મંજૂરી આપી એ ઈસ્ટબુલ સંમેલન અંતર્ગત બળાત્કાર તથા જાતીય પ્રકારના, (સ્ત્રીની) સંમતિ વિહોણા અન્ય તમામ કૃત્યોને ફોજદારી ગુન્હો ગણવામાં આવશે. અત્યાર સુધી સ્લોવેનિયાના ફોજદારી ગુન્હાસંબંધી કાયદોઓમાં કોઈ કૃત્યને બળાત્કાર ગણવા માટે, બળપ્રયોગ થયો હોવાનો કે બળપ્રયોગ અને હિંસાની ધમકી આપી હોવાનો પુરાવો જરૂરી બનતો હતો.

## આફ્રિકામાં મહિલાએ એક સાથે 10 બાળકો જન્મ આપી રેકોર્ડ સર્જ્યો

કેપટાઉન

તાજેતરમાં આફ્રિકન દેશ માલીની એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો.જોકે આ રેકોર્ડ લાંબો સમય ટક્યો નથી.હવે સાઉથ આફ્રિકાની એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને આ રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

37 વર્ષની મહિલા ગોસિયામી થમારા સિટહોલે આ રેકોર્ડ બનાવ્યો છે.તેણે સિઝેરિયન ઓપરેશન થકી એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો છે.બાળકો અને માતા સ્વસ્થ છે તેવું ડોક્ટરોનું કહેવું

છે. આ 10 બાળકોમાં સાત બોયઝ અને 3 ગર્લ્સ છે. ગોસિયામીનું કહેવું છે કે, મને અને મારા પતિને આઠ બાળકોની આશા હતી. ડોક્ટરોએ અમને આ વાત પહેલા જણાવી હતી. જોકે એ પછી સ્કેન કરવામાં આવ્યું તો ખબર પડી હતી કે, હું 10 બાળકોની માતા બનવાની છું.આ પહેલા બે બાળકો સ્કેનમાં દેખાયા નહોતા. ગોસિયામી આગળ કહે છે કે, શરુઆતમાં તો હું મારી પ્રેગનન્સીને લઈને હેરાન હતી. મારા માટે તો આટલા બાળકો જન્મશે તે વાત ગળે ઉતરવા મુશ્કેલ બની રહી હતી. હું બીમાર પણ પડી ગઈ હતી.

## ૨૦૨૧માં વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર 5.6% રહેવાની શક્યતા : વર્લ્ડ બેંકનો દાવો

વોશિંગ્ટન

૨૦૨૧માં વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર ૫.૬ ટકા રહેવાની શક્યતા છે તેમ વર્લ્ડ બેંકે તાજેતરમાં પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે. છેલ્લા ૮૦ વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રનો આ સૌથી વધુ દર વિકાસ દર હશે. આ અહેવાલ મુજબ ચાલુ વર્ષે કેટલાક પ્રમુખ અર્થતંત્રમાં મજબૂત રિકવરીના અંદાજને પગલે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર ૫.૬ ટકા રહેવાની શક્યતા છે. કોરોના મહામારી અગાઉ મૂકાયેલા અંદાજ કરતા આ વિકાસ દર હજુ પણ બે ટકા ઓછો છે. ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સમાં આ સાથે પણ એ પણ જણાવવામાં આવ્યું છે કે અનેક ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થતંત્રોનો કોરોના મહામારી સામેનો સંઘર્ષ ચાલુ રહેશે.

10 હજાર મીટર રેસમાં  
ઇથોપિયાની લેટેસેનબેટ  
ગિડી ચેમ્પિયન બની



હેન્જેલો (નેધરલેન્ડ્સ) : ઇથોપિયાની લેટેસેનબેટ ગિડીએ નેધરલેન્ડ્સમાં યોજાયેલી ઇથોપિયન ઓલિમ્પિક ટ્રાયન્સની વિમેન્સ ૧૦ હજાર મીટર રેસમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. બે દિવસ પહેલાં જ સિફાન હસને આ ટ્રેક ઉપર ૧૦ હજાર મીટર રેસનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. ગિડીએ ૨૯ મિનિટ ૧:૦૩ સેકન્ડના સમય સાથે ૧૦ હજાર મીટર રેસ પૂરી કરી હતી. સિગી ગેબ્રેસેલામા ૩૦ મિનિટ ૦૬.૦૧ સેકન્ડ સાથે બીજા ક્રમે રહી હતી. સિફાન હસને ફેની બ્રેન્કર્સ કોર્ઠન ગેમ્સમાં રેકોર્ડ નોંધાવ્યો હતો અને તેના ટાઈમિંગમાં ગિડીએ ૫.૭૯ સેકન્ડનો સુધારો કરીને નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઇથોપિયામાં જન્મેલી નેધરલેન્ડ્સની સ્પિન્ટર હસને બે દિવસ પહેલાં પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગિડી આ રીતે નોર્વેની ઈબ્રિડ ક્રિસ્ટિયનસેન બાદ પાંચ હજાર અને ૧૦ હજાર મીટરનો રેકોર્ડ ધરાવનાર પ્રથમ મહિલા સ્પિન્ટર બની ગઈ છે.

# ફૂટબોલ યૂરો કપ 2020નો 11મીથી પ્રારંભ

યૂરો કપના ઇતિહાસમાં પ્રથમ વખત 11 દેશ સંયુક્ત રીતે ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યા છે

રોમ: ફિફા વર્લ્ડ કપ બાદ વિશ્વની સૌથી વધુ લોકો નિહાળતા અને લોકપ્રિય ફૂટબોલ યૂરો કપ ૨૦૨૦નો ૧૧મી જૂનથી (૧૨મીએ વહેલી સવારે ૧૨:૩૦ વાગ્યે) પ્રારંભ થઈ રહ્યો છે. ટાઈટલ મુકાબલો ૧૧મી જુલાઈ રમાશે. ઓલિમ્પિકની જેમ પ્રત્યેક ચાર વર્ષે રમાતી આ ટૂર્નામેન્ટ ગયા વર્ષે યોજાવાની હતી, પરંતુ કોરોના વાઈરસની મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. ૨૪ ટીમોમાં પોર્ટુગલ ડિક્લેરિંગ ચેમ્પિયન છે અને ૨૦૧૬માં તેણે યજમાન ફ્રાન્સને ૧-૦થી હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. યૂરો કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ જર્મની અને સ્પેન છે. આ બંને ટીમે ત્રણ-ત્રણ વખત યૂરો કપ



જીત્યો છે. યૂરો કપની ૧૬મી સિઝનમાં અત્યાર સુધી કુલ ૧૦ ટીમો ચેમ્પિયન બની છે. સ્પેનની ટીમ એકમાત્ર એવી છે જેણે સતત બે વખત ટાઈટલ જીત્યું હતું. સ્પેને ૨૦૦૮ અને ૨૦૧૨માં યૂરો કપ જીતીને ફૂટબોલ જગતમાં

પોતાનો દબદબો મેળવ્યો હતો. યૂરો કપના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૧ દેશ સંયુક્ત રીતે આ વખતે ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યા છે. તમામ ૨૪ ટીમોને જ-જના છ ગ્રૂપમાં સ્થાન અપાયું છે. પ્રત્યેક ગ્રૂપની ટોપ-૨ ટીમ પ્રી-

ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે અને તમામ ગ્રૂપની ત્રીજા ક્રમે રહેલી ટોપ-૪ ટીમ રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ કરશે. સેમિફાઈનલ અને ફાઈનલ લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે રમાશે. ૨૦૨૧ના માર્ચ મહિનામાં યુઈએફએની એક્ઝિક્યુટિવ સમિતિની બેઠકમાં કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને મેચમાં ત્રણના બદલે પાંચ સબસ્ટિટ્યૂટ આપવાનો નવો નિયમ અમલમાં મૂક્યો છે. યૂરો ૨૦૨૦ કપનું આયોજન ગયા વર્ષે થવાનું હતું, પરંતુ કોરોના વાઈરસના કારણે તેને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જોકે આયોજન સમિતિએ તેને ચાલુ વર્ષે પણ યૂરો ૨૦૨૦ તરીકે જ રમાડવાનો નિર્ણય કર્યો હતો.

## શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર

લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ચાહકોને આશા હતી કે શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ટીમ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. મુખ્ય ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં ડાજર છે. જેના કારણે ભારતની બી ટીમ શ્રીલંકાના પ્રવાસ પર જશે. જેના માટે આજે ટીમની ઘોષણા કરવામાં આવી છે. આ ટીમમાં ૬ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

શ્રેણી રમવાની છે. જેના માટે ભારતની બી ટીમ પ્રવાસ કરશે. મુખ્ય ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ માટે બ્રિટનમાં છે. જેના કારણે ટિગ્ગજ ઓપનર શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો બીજી તરફ અનુભવી ભુવનેશ્વર કુમાર ટીમના ઉપ-કેપ્ટન રહેશે. ટી-20 અને વનડે બંને ફોર્મેટ માટે સમાન ટીમની પસંદગી કરવામાં આવી છે. જેમાં 20 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

## સ્પોન્સર વિના ભારતીય એથલેટ્સ ટોક્યો ગેમ્સમાં ભાગ લેશે, ચાઈનીઝ કંપની રદ

નવીદિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં નોન-બ્રાન્ડેડ એટલે કે સ્પોન્સરના લોગો વિના ભાગ લેશે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને સ્પોર્ટ્સ ગુડ્સ બનાવનારી કંપની લી નિંગને પોતાની સત્તાવાર કિટ પાર્ટનરના સ્વરૂપમાંથી હટાવી દીધી છે. આ કારણથી ભારતીય એથલેટ્સને સ્પોન્સરના લોગો વિના રમવું પડશે. દેશભરમાં

ચાઈનીઝ વસ્તુઓના સતત થઈ રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને એસોસિએશને આ નિર્ણય લીધો હતો. આઈઓએ દ્વારા ગયા સપ્તાહે ઓલિમ્પિક માટે લી નિંગની કિટ લોન્ચ કરી હતી, પરંતુ તેના કારણે સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ રમતમંત્રાલયે પણ આઈઓએને ઓલિમ્પિક માટે ચાઈનીઝ કંપનીને સ્પોન્સર તરીકે નહીં રાખવાનો આદેશ કર્યો હતો.

# HONEST - DEDICATED - TEAMWORK

*Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.*

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

**JUST LISTED** Markham/Ellesmere  
\$399,000

Stunning Condo With Extra Ordinary Features With Private Dining Room, Private Theater, Party Room, Outdoor Pool, & Tanning Area. Best Location, Minutes To Hwy 40, Scarborough Town Centre, Centennial College, University Of Toronto, Banks, Convenience Stores Etc... Ideal For Investors And 1st Time Buyers Could Be Purchased With 5% Down Payment. Don't Miss The Opportunity To Buy And Rent Or Live Next To U Of T (Scarborough) / Centennial College.

**JUST LISTED** Morningside And Staines  
\$799,000

Mattamy Built Semi Detached Home In Rouge Community. Beautiful 3 Bedrooms + 4 Washrooms. Hardwood Floor In Main And 2nd Floor. With Oak Stairs. Modern Kitchen With Quartz Counter Top And S/S Appliances, Open Concept. Step To Brookside School. 24 Hours Tlc, Mall Plaza, Highways And Places Of Worship. Extras: S/S Fridge, S/S Stove, S/S Dishwasher And S/S Washer/Dryer, 2 Gd Openers And Elf And A/C Unit. California Shutters. Must Certified Deposit Cheque. Attached Schedule B And Form 801 With All The Offers. Custom Built W/In Closet In Master Bdrm

**JUST LISTED** Ashburn/Vipond/ Darius Harns (Whitby)  
\$799,000

This Gorgeous North Whitby Family Home Nestled In A Highly Sought After Brooklin Community! Located On A Quiet Street. Finished Top To Bottom Move In. Steps To Public And Catholic Schools, Parks And Amenities. Close To Hwy 407/412 To 401. Steps To Public And Catholic Schools, Parks And Amenities. Transit. Garage Entry Form Inside The Home, Walkout To Fully Fenced Good Size Backyard. Finished Basement.

**NEED MORE LISTINGS, CALL US FOR SPECIAL DEALS**

CALL US FOR FURTHER INFORMATION OR TO BOOK A SHOWING TO VIEW PROPERTIES.

**Use The Advantage of a Team, Because...Teamwork Makes Your Dreams Work !**

**અમારી મફત સલાહનો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો**

**Shamim & Amin Kharodia**  
Sales Representatives  
info@kharodiarealestate.com  
647.501.6786 SHAMIM | 647.308.2941 AMIN

**Century 21**  
BRAND POWER & INNOVATIVE TECHNOLOGIES TO GET YOUR HOME RECOGNIZED!  
2250 MARKHAM ROAD, UNIT 3  
TORONTO, ON, M1B 1W3  
OFFICE : 416 298 8383 FAX : 416 298 8303

MASTERS RUBY

Grand Century Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



# CLUB CERAMIC



Lapoto Finish

પોર્સેલિન  
ટાઈલ્સ શરૂ થાય  
છે ફક્ત  
\$ 0.89 થીPorcelain tiles starting from  
**\$0.89** per square  
feet only

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking



Matt Fiish

Ceramic tiles starting from  
**\$0.50** per square  
feet onlyસિરામિક  
ટાઈલ્સ શરૂ  
થાય છે  
\$ 0.50 થી

- ◆ પોર્સેલિન ટાઈલ્સ અને સિરામિક ટાઈલ્સ ફેક્ટરી ભાવે મળશે
- ◆ અમારા ભાવની ખાત્રી કરી શકો છો. વધારાના ૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે
- ◆ ફ્લોર, દિવાલ અને આઉટડોર પાર્કિંગની ટાઈલ્સ મળશે

-: Available Size :-

24" \* 24" | 12" \* 24" | 24" \* 48" | 4" \* 8" | 4" \* 12"

**MONTREAL**3590, Rue Griffith, Saint Laurent, QC, H4T 1A7  
Phone: +1-514-260-2242 /  
+1-514-813-3850**OTTAWA**Unit #4+5, 200 Colonnade Road,  
Nepean, ON, K2E 7M1  
+1-613-601-1474**MISSISSUAGA**5030 Maingate Drive, Unit#1, Mississauga, L4W 1X5  
Phone: +1 (647) 527-6030 /  
+1-514-813-3850<https://clubceramic.com> Email : [sales@clubceramic.com](mailto:sales@clubceramic.com)

**Chapel  
Ridge**

FUNERAL HOME  
& CREMATION CENTRE

**416.993.0826**  
**24/7 # 905.305.8508**



તમારી સગવડ માટે અમે બે ફ્યુનરલ સેન્ટર ઓફર કરીએ છીએ. મારખમ અને મિસિસાગા. સંપૂર્ણ હિન્દુ તથા જૈન વિધિની સગવડતા. (St. John's Dixie, 737 Dundas St. E., Mississauga, ON L4Y 2B5)

**ફ્યુનરલ સર્વિસ, બેઝિક કાસ્કેટ, ક્રિમેશન અને ટેક્સ બધાં સાથે ટોટલ ફક્ત \$4270**

વધુ માહિતી માટે ફોન કરો. અમારો પ્રોફેશનલ સ્ટાફ તમારી ભાષામાં તમને માહિતી આપશે.  
પ્રિપેઇડ ફ્યુનરલ અને ટ્રાવેલ ઈન્સુરન્સ

1. તમારા ડોલર ફ્યુનરલ હોમમાં જમા નહિ થાય. પરંતુ સરકારે નીમેલી ટ્રસ્ટ કંપની પાસે રહેશે.
2. એક વખત પ્લાન ખરીદ્યા પછી તમે કે તમારા ફેમિલીએ કદીપણ વધુ પૈસા નહિ આપવા પડે.
3. ટ્રાવેલ ઈન્સુરન્સ - ફક્ત \$595 એક વખત આપી જિંદગી ભર તમે ક્યાંય પણ નિશ્ચિત ટ્રાવેલ કરી શકશો. \*

\* This is not a general insurance. Applies only in case of a death away from home.

8911 Woodbine Avenue, Markham, Ontario L3R 5G1  
[www.chapelridgefh.com](http://www.chapelridgefh.com) • [info@chapelridgefh.com](mailto:info@chapelridgefh.com)